

4th September, 2021

To. The Corporate Relations Department **BSE Limited** P. J. Towers, Dalal Street. Mumbai-400001, Maharashtra

Sub.: Newspaper publication of Notice of the 10th Annual General Meeting of the Company & Book Closure

Scrip Code: 540492

Dear Sir/Madam,

Pursuant to the provisions of Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are pleased to enclose herewith a Newspaper copy of Notice of the 10th Annual General Meeting of the Company & Book Closure published in "Financial Express" (English) and "Gujarat Guardian" (Gujarati) newspaper dated 4th September, 2021 as required under Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Kindly take the same on your record.

Thanking you,

Yours faithfully,

For STARLINEPS ENTERPRISES LIMITED

KHUSHBOO MODI

Company Secretary & Compliance Officer

ACS No.: 57323

Encl: As above



Hindustan Unilever Limited.

Unilever House, B. D. Sawant Marg, Chakala, Andheri (E), Mumbai - 400 099. Notice is hereby given that the Certificate(s) for the under mentioned Equity Shares of the Company have been lost/misplaced and the holder(s)/purchaser(s) of the said Equity Shares have applied to the Company to issue duplicate Share Certificate(s).

Any person who has a claim in respect of the said Shares should lodge the same with the company at its Registered Office within 15 days from this date else the Company will proceed to issue duplicate certificate(s) to the aforesaid applicants without any further intimation.

Name of the	Folio Na.	No. Of	Distinctive Nos.	Certificate
Share Holder		Shares		Nos.
Shailesh Biharilal		40	184241789-184241828	2249102
	HLL2935517	50		2532577
Patel		50	64092778-64092927	2532578
		50		2532579
		50		2532580
		50	109885167-109885316	2532581
		50		2532582
		22	6847476-6847497	2532583
		- 5	14591126-14591130	2532583
		22	18255819-18255840	2532583
		1 32	18262561-18262593	2532583 2532584
		18	22924303-22924320	2532584
		50 10	35948972-35949031	2532585 2532586
		10	64092928-64092937	2532586
		10	109885317-109885626	2532586
	TOTAL	520		

PLACE: PUNE DATE: 04th September, 2021

Name of the Shareholder/s:-SHAILESH BIHARILAL PATEL

STARLINEPS ENTERPRISES LIMITED

(formerly known as Starline Precious Stone Limited and Pure Giftcarat Limited) (CIN: L36910GJ2011PLC065141)

Reg. Off.: Shop - F/1, 1st Floor, Athwa Ark Shopping Centre, Opp. Yatim Khana, Athwa Gate, Surat-395001, Gujarat Phone No.: 0261-2600343, Mob.: +91-7043999030 Email: info@starlineps.com, Website: www.starlineps.com

NOTICE OF THE 10TH ANNUAL GENERAL MEETING OF THE COMPANY & BOOK CLOSURE & E-VOTING INFORMATION

NOTICE IS HEREBY GIVEN that the 10th Annual General Meeting (AGM) of the members of the STARLINEPS ENTERPRISES LIMITED (formerly known as Starline Precious Stone Limited and Pure Giftcarat Limited) will be held on Monday, the 27th September, 2021 at 12:30 p.m. at the Registered Office of the Company situated at Shop - F/1, 1st Floor, Athwa Ark Shopping Centre, Opp. Yatim Khana, Athwa Gate, Surat-395001, Gujarat, to transact the business mentioned in the Notice of the 10th Annual General Meeting sent along with the Explanatory Statement, Directors' Report, Auditor's Report and Audited Financial Statements of the Company for the financial year ended 31st March, 2021.

The Annual Report for the Financial Year 2020-21 containing the Notice, Attendance Slip and Proxy Form has been sent on 3rd September, 2021 to all the Members whose names appears on the Register of the Company as on 27th August, 2021. Please note that there will be no dispatch of physical copies of notices to the members of the Company as per MCA circulars. These documents are also available on the website of the Company www.starlineps.com and on the website of National Securities Depository Limited (NSDL) http://www.evoting.nsdl.com.

Notice is further given that pursuant to Section 108 of the Companies Act, 2013, Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing electronic voting facility from a place other than the venue of AGM ("remote e-voting") provided by NSDL, on all the Resolutions set forth in the Notice. The details of remote evoting are given below:

- (I) The remote e-voting will commence on Friday, 24th September, 2021 (9:00 a.m.) and end on Sunday, 26th September, 2021 (5:00 p.m.), The e-voting module shall be disabled for voting thereafter.
- (ii) The voting rights of Members shall be in proportion to their Shares of the Paid-up Share Capital of the Company as of the cut-off date i.e. 20th September, 2021.
- (iii) Any person who acquires Equity Shares of the Company and becomes a Member after 3rd September, 2021, i.e. date of dispatch of the Notice and holding shares as of the cut-off date i.e. 20th September, 2021, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or info@starlineps.com.
- (iv) Once a vote is cast by a Member, he/she shall not be allowed to change it subsequently.
- (v) The Members who cast their vote by remote e-voting may also attend the AGM but shall not be entitled to cast their vote again.

In case of any queries pertaining to e-voting, members may refer to the Frequently Asked Questions (FAQs) for members and e-voting user manual for members available at the Downloads section of http://www.evoting.nsdl.com / or contact Ms. Pallavi Mhatre, Assistant Manager, NSDL, 4th floor, 'A' Wing, Trade World, Kamala Mills Compound, Lower Parel, Mumbai-400013; at e-mail: pallavi@nsdl.co.in Telephone No.: 022-24994545 & Toll Free No.: 1800-222-990.

Notice is further given that pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 read with applicable rules and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from 21st September, 2021 to 27th September, 2021 (both days inclusive).

By Orders of the Board of Directors For STARLINEPS ENTERPRISES LIMITED KHUSHBOO MODI Company Secretary & Compliance Offi ACS No.: 57323

IEL LIMITED

Place: Surat

Reg. Off. - Shed No 15, Shyam Hari Industrial Estate, Phase 4. GIDC, Vatva, Ahmedabad-382445, Gujarat Phone: 022-2204 4422, Fax: 022-2204 6024 Website: www.nanavatigroup.com, E-mail: iel@nanavatigroup.com

CIN - L15140GJ1956PLC124644 NOTICE OF THE 65TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND

the physical presence of the Members at a common venue.

to avail the remote e-voting facility or e-voting during the AGM.

E-VOTING INFORMATION Notice is hereby given that the 65th Annual General Meeting (AGM) of the Shareholders of the Company will be held on Wednesday, 29th September, 2021 at 03:00 PM IST through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice of the 65" AGM in compliance with the applicable provisions of the Companies Act, 2013 ('Act') & Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('Listing Regulations') read with General Circular Nos. 14/2020, 17/2020 and 20/2020 dated April 08, 2020, April 13, 2020 and May 05, 2020, December 31, 2020, January 13, 2021 and June 23, 2021 respectively, issued by the Ministry of Corporate Affairs ('MCA Circulars') and Circular No. SEBI/HO/CFD/CMD1 CIR/P/2020/79 dated May 12, 2020 issued by the Securities and Exchange Board of India ('SEBI Circular') to transact the businesses as mentioned in the 65" AGM Notice, without

Pursuant to Section 101 of the Act read with Rule 18 of the Companies (Management and Administration) Rules, 2014, Regulation 36 of the Listing Regulations, Secretarial Standard on General Meetings (SS-2) and in compliance with the MCA Circulars and SEBI Circular, the Notice of 65° AGM along with the Annual Report 2020-21 have been sent on Friday, 03° September, 2021 by email to those members whose email addresses are registered with the Company / Registrar and Share Transfer Agent / Depositories. The requirements of sending physical copy of the Notice of the 65th AGM and the Annual Report 2020-21 to the Members have been dispensed with vide MCA Circulars and SEBI Circular. Members are hereby informed that the said AGM Notice is also available on the Company's website www.nanavatigroup.com, website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and on the website of Central Depository Services (India) Limited (CDSL)

Pursuant to Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and dministration) Rules, 2014, as amended from time to time. Requiation 44 of the Listin Regulations and SS-2, the Company is providing its members the e-voting facility to cast their votes on the resolution set out in the AGM Notice by using an electronic voting system from a place other than the venue of the AGM (i.e. remote e-voting). The Company will also provide a facility of e-voting to members during the AGM, who have not cast their vote by remote e-voting. The Company has entered into an arrangement with CDSL for providing the remote e-voting. A person whose name appears on the Register of Members / Beneficial Owners as on the cut-off date i.e. Wednesday, 22th September, 2021 shall only be entitled

The remote e-voting period will commence on Sunday, 26th September, 2021 (09:00 AM IST) and will end on Tuesday, 28th September, 2021 (05:00 PM IST). During this period, the member(s) of the Company may cast their votes electronically on items mentioned in the AGM Notice. The remote e-voting shall be disabled for voting by CDSL after 05.00 p.m. IST on Tuesday, 28th September, 2021. Once the vote on a resolution is cast by a member, any subsequent change shall not be allowed. The voting rights of the members shall be in proportion to their shares in paid-up share capital of the Company as on the cut-off date i.e. Wednesday, 22rd September, 2021. The detailed instructions relating to remote e-voting and e-voting during the AGM are provided in the Notes forming part of the 65th AGM Notice.

Only those Members, who will be present in the AGM through VC / OAVM and have not cast their vote on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system available during the 65th AGM. Members who have cast their vote through remote e-voting will be eligible to attend the AGM. However, they will not be eligible to vote at the AGM. Any person, who becomes a member of the Company after sending of the AGM Notice by

email and holding shares as on Wednesday, 22rd September, 2021, may refer to the AGM Notice and obtain the login ID and password from CDSL by sending a request at iel@nanavatigroup.com. Members whose email id is not registered, may refer "Process for those shareholders whose email addresses are not registered with the Depositories/Company RTA for obtaining login credentials for e-voting as detailed in 65th AGM Notice. In case of any queries or issues regarding remote e-voting, members may refer to the

Frequently Asked Questions (FAQs) and e-voting manual available at www.evotingindia.com under help section or contact Mr. Rakesh Dalvi, Manager, CDSL, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N. M. Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 at e-mail: helpdesk.evoting@cdslindia.com, Tel. No.: 022-23058542/43.

Pursuant to Section 91 of the Act read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of the Listing Regulations, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from 23th September, 2021 to 29th September, 2021 (both days inclusive) for the purpose of 65th AGM. For IEL Limited

Ronit Champakial Shah Date : September 03, 2021 Place : Ahmedabad Managing Director DIN: 02851806

RISA INTERNATIONAL LIMITED

CIN: L99999MH1993PLC071062 Regd Office: 7/A, Plot No. 27/33, Beaumoon Chambers, 2rd Floor, Nagindas Master Lane, Hutatma Chowk, Fort, Mumbai - 400001, Tel: +91 22-66668104 email: risainternationalitd@gmail.com, website: www.risainternational.com

SI No	Particulars	Company of the last of the las	Quarter Ended 31.12.2020 Unaudited	PROPERTY AND PERSONS ASSESSED.	Year Ended 31.03.2021 Audited	Year Ended 31.03.2020 Audited
1	Total Income from Operations	0.07	0.00	6.13	1.81	6.13
2	Net Profits/ (Loss) for the period (before tax, exceptional and/ or extraordinary items)	(315.94)	(8.60)	(1010.53)	(331,46)	(1030.91)
3	Net Profits/ (Loss) for the period before tax (after exceptional and/ or extraordinary items)	(315.94)	(8.60)	(1010.53)	(331.46)	(1030.91)
4		(315.94)	(8.60)	(1010.53)	(331,46)	
5	Total comprehensive income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive income (after tax)]	(315.94)	(8.60)	(1010.53)	(331:46)	(1030.91)
6	Equity Share Capital (Face Value of Rs. 2/- each)	3190,0050	3190.0050	3190.0050		No. of the last of
7	Reserves (excluding Revaluation reserve as shown in the Audited Balance Sheet of Previous Year)	0.00	0.00	0.00	0.00	0.00
В	Earning Per Share (of Rs.2/- each) 1. Basic 2. Diluted	(0.00) (0.00)	(0.00) (0.00)	(0.63)	(0.21)	(0.65)

The above is an extract of the detailed format of Audited Financial Results for Quarterly & Year ended 31.03.2021 filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results for the Quarter and Year ended on 31st March, 2021 is available on the Stock Exchange website www.bseindia.com and on the company website i.e www.risainternational.com

The above Audited Results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 02rd September, 2021. The Statutory Auditors of the Company have provided the Audit Report on these financial results with unmodified opinion for the year ended on 31st March, 2021.

For and on behalf of the Board

Abhinandan Jain Date: 02.09.2021 Wholetime Director & CFO Place: Mumbai DIN: 03199953



Indian Overseas Bank

Ichalkaranji Branch - (2743) 12/28 "Tirupati" Main Road, Near Sriram Terrin Centre, Ichalkaranji -416115 Ph.: 0230-2426243; e-mail - iob2743@iob.in

Under Section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (SARFAESI Act) read with Rule 3(1) of the security interest (Enforcement), Rules, 2002 (Rules)

 Whereas the undersigned being the Authorised Officer of Indian Overseas Bank under SARFAESI Act and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3, issued Demand Notice under Section 13(2) of the said Act, calling upon the Borrower/ mortgagor listed hereunder (hereinafter referred to as the "said Borrowers"), to repay the amounts mentioned in the Notice, within 60 days from the date of receipt of Notice, as per details given below.

2. The said Notices have been returned undelivered by the postal authorities / have not been duly acknowledged by the Borrower / Mortgagors / Guarantors. Hence the Bank by way of abundant caution is effecting this publication of the demand notice. The undersigned has, therefore, caused these Notices to be pasted on the premises of the last known addresses of the said Borrower/ mortgagors/ guarantors as per the said Act. Copies of the said Notices are available with the undersigned and the said Borrowers/ mortgagor / guarantors. May, if they so desire, collect the said copies from the undersigned on any working day during

Against the above background, Notice is hereby given, once again, to said Borrower/ Mortgagor / Guarantors to pay to Indian Overseas Bank, within 60days from the date of publication of this Notice, the amounts indicated / payable as given below under the loan & other documents. As security for due repayment of the loan, the following assets have been mortgaged to Indian Overseas Bank by the respective parties as below.

Sr. No.	Name of the Borrowers / Mortgagors / Guarantors with address	Total outstanding* as on 31/08/2021	Date of NPA	Date of Demand Notice
1.	Mr. Sudhakar Sitaram Ravande & Mr. Sitaram Keshav Ravande Address - Near Mahasiddha Mandir, Chandur, Ichalkaranji, Tal - Hatkanangale, Dist Kolhapur, Maharashtra – 416116	Rs. 21,56,642.23	30/04/2021	28/05/2021

Description of Secured Assets: Nonagricultural Gavthan land bearing CTS No. 429 admeasuring 293.60 Sq. Meters along with building there on bearing Gram Panchayat Milkat No. 1254 in Chandur Village, Ichalkaranji, Tal - Hatkanangle, Kolhapur - 416116 in the name of Mr. Sitaram Keshav Ravande. Boundaries: East: By Property Bearing Survey No.85, West: By Road, North: By Property Bearing Survey No.428, South: By Property Bearing Survey No.430 & 431.

Payable with further interest at contractual rates/rests as agreed from the date mentioned above till date of

4. If the said Borrowers/mortgagor/Guarantors fails to make payment to Indian Overseas Bank as aforesaid, then Indian Overseas Bank shall proceed against the above secured assets under Section 13(4) of the SARFAESI Act and Rules entirely at the risks, costs and consequences of the said Borrowers/mortgagor/Guarantors.

Further, the attention of Borrowers/mortgagor/Guarantors. is invited to provisions of Sub-section (8) of the Section 13 of the Act, in respect of time available to them to redeem the secured assets.

6. The said Borrowers/mortgagor/Guarantors is prohibited under the SARFAESI Act from transferring the secured assets, whether by way of sale, lease or otherwise without the prior written consent of Indian Overseas Bank. Any person who contravenes or abets contravention of the provisions of the Act or Rules shall be liable for imprisonment and/ or fine as given under Section 29 of the Act.

Date: 04/09/2021 Place: Pune

Chief Manager & Authorized Officer, Indian Overseas Bank

Rs 17,95,126.72



Interest (Enforcement) Rules 2002.

BTL

बैंक ऑफ़ बड़ौदा बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

Bank of Baroda Highway Branch, Deesa, Near Dipak Hotel, Krishna Arcade, Deesa Palanpur highway, Deesa 385535 Email: deesa@bankofbaroda.co.in Phone: 02744 230064

Demand Notice

Demand Notice under Section 13(2), read with section 13(13), Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. A/c - M/s. Mali Kaluji Chamnaji, a Proprietorship Firm of Mr Kaluji Chamnaji Mali of credit facility with Our Highway Branch Deesa.

M/s. Mali Kaluji Chamnaji, Proprietor-Mr Kaluji Chamnaji Mali (Borrower) 21, Sardar Patel Shopping Center, Deesa Dist. Banaskantha 385535 Also at: Malivas, Opposite Rabari Vas, Ranpur (Ugamana vas), Ranpur, Taluka-Deesa,

. Mr Sureshkumar Dahyaji Mali (Guarantor) Maruti Park, Tin Hanuman Road, AT/PO:Deesa, Dist:Banaskantha-385535 The undersigned has issued demand notice dated 29.05.2021 to you i.e. Borrower & Guarantor under Section 13(2) of Securitisation and Reconstruction of financial Assets and Enforcement of Security Interest Act 2002 on your last known addresses, however the said notice could not serve to you in ordinary course. Hence, we hereby serve the said notice dated 29.05.2021 to you (borrower/guarantor) through substitute mode of service as prescribed in rule of 3(1) of The Security

A notice is hereby given that you (above borrower) have committed defaults in loan account of M/s. Shree Ganesh Cold Storage, a partnership firm, account with Deesa Main Branch (e-Dena Bank Branch), wherein you are one of the partners. Accordingly, the said account was classified as Non Preforming Assets (NPA) on 31.03.2018. Subsequently your BTL Account No. 09580400001408 with Highway Branch has been classified as non-performing asset on 31.03.2021 in accordance with the Reserve Bank of India directives and guidelines. In spite of our repeated requests and demands you have not repaid the overdue loans including interest thereon.

The details of the credit limits and the Outstanding against each credit facility are as under: (Amount in Rs.) Outstanding as on 31.03.2021 Nature & Type of Facility Limit (Rs.) In lakhs Rate of Interest inclusive of interest up to 31.03.2021)

45.00 Lakh

Account No. 09580400001408 P.A. With monthly Rest You are also liable to pay further contractual rate of interest on the above amount w.e.f 01.04.2021 till realization. Since entire amount is overdue, you are also liable to pay penal interest of 2% p.a on simple basis. Please note that the Bank has calculated and claimed penal interest of 2% p.a. on simple basis.

9.20% (BRLLR+2.45%)

Security agreement with brief description of securities

 All piece and parcel of the open Residential Plot No. 48, 49, 50, 51 & 52 admeasuring 757.50 SQM R.S No. 213- 212/2 paiki in the SIM of village Rajpur, Tah: Deesa, District: Banaskantha in the name of Shri Kaluji (Kalidas) Chamanaji Mali and Boundaries: Plot no 48: North: 212/2p, South: 6 meter Internal way, East: 7.50 meter internal road, West: Land of plot no.49. Plot no 49: North: Plot no 212/2p, South: 6 meter internal road, East: Plot no 48, West: Plot no 50: Plot no 50: North: Plot no 212/2p, South: 6 meter internal road, East; Plot no 49, West; Plot no 51, Plot no 51; North; Plot no 212/2p, South: 6 meter internal road, East: Plot no 50, West: Plot no 52. Plot no 52: North: Plot no 212/2p, South: 6 meter internal road, East: Plot no 51, West Common Plot.

The above properties were mortgaged with Bank of Baroda, Deesa Branch through Equitable Mortgage on 24.01.2003 extension on mortgage on 17.12.2007 and further extension on mortgage on 16.08.2010 vide "Extension of Mortgage by Deposit of Title Deed" which was registered vide No 7224 with sub registrar Deesa dated 16.08.2010. 2. Letter of Guarantee dated 16.08.2010

You are advised to make the payment of Rs 17,95,126.72 (Rupees Seventeen lakh Ninety Five Thousand One Hundred Twenty Six and paise seventy two only) plus further contractual rate of interest till full and final payment, within 60 days from the date of publication of this notice failing which the Bank as a secured creditor shall be entitled to enforce its security interest without intervention of the Court or Tribunal by taking recourse to one or more of the measures under Chapter - III of the Act including (but not limited to) taking over of the possession and sale or Management of the Assets charged to the Bank for realizing the Bank's dues at your own risk as to the costs and consequences thereof.

We further invite your attention to sub section (8) of section 13 of the said Act in terms of which you may redeem the secured assets, if the amount of dues together with all costs, charges and expenses incurred by the Bank is tendered by you, at any time before the date of publication of notice for public auction/ inviting quotations/ tender/ private treaty. Please note that after publication of the notice as above, your right to redeem the secured assets will not be available. Please note that after receipt of this notice in terms of section 13 (13) of the Act you shall not transfer by way of sale, lease or

otherwise (other than in the ordinary course of your business) any of the assets hypothecated/ mortgaged to the Bank without prior consent of the Bank. We may add that non-compliance with this provision is punishable under section 29 of the Act. Please further note that this statutory notice is issued without prejudice to all the other rights and remedies available to the Bank, for recovering its dues from you.

Date : 29.05.2021

The Authorised officer, Chief Manager, Bank of Baroda, Highway Branch, Deesa Place : Deesa

FPSB Pune Sahakari Bank Ltd., Pune

Maurya Residency, 1388, Shukrawar Peth, Near Sangam Sadi Centre Lane, Pune - 411002

POSSESSION NOTICE

this 31st day of Aug. of the year 2021.

1) Suresh Anandrao Raje

2) Atmaram Shankar

Nalawade

Place: Pune

[Apendix IV under the Act - rule - 8(1)]

Whereas the undersigned being the Authorized Officer Pune Sahakari Bank Ltd. Pune under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and (54 of 2002) in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand notice dated 12.11.2018 calling upon the borrowers / guarantors / mortgagors to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred in on him/her under Section 13 (4) of the said Act read with rule 8 of the said rules on

The Borrower's / Guarantor's / Mortgagor's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower in particular and the public in general is hereby caution not to deal with the property and any dealing with the property will be subject to the charge of Pune Sahakari BankLtd. for an amount mentioned below and interest thereon.

The Details of the Property Mortgaged to the bank and taken possession by the bank are as follows:

Sr. Name of Borrowers / Outstanding Description of the Mortgaged property Guarantors / Mortgagors Amount 1 M/s Prabbiling Situated at Karvenagar, Hingane Budruk Rs. 2150530/-Construction Prop. Hingane Home Colony, Plot No. 20, Sr. no. 19 (Rupees Twenty Siddhu Basavaraj Hissa No.1 + 8 B, City Sr. No.241, Pune-411053 One lac Fifty Area -115 Sq.Meter (1235 Sq.Feet) Bounderies: Madani 1) Ambadas Thousand Five Hanumant Kurhade 2) Towards East: Property Onamshetty 1/2 **Hundred Thirty** remaining space, Towards South: 10' feet Road Chandrashekhar Only) + Int Basavraj Madani Towards West: open space, Towards North: 40' feet Road Situated at At. Po. Khadakawasala, Sr. No. 26 M/s. Bharat Enterprises Rs. 1520509/-Hissa No. 23, A B, 23 B/1/2/1, House No. 205/K Prop. Bharat Dattu Mate (Rupees Fifteen

lac Twenty

Thousand Five

Hundred Nine

Only) + Int

Gulab Satpute and Road Date: 31.08.2021

राष्ट्रीय परीक्षा एजेंसी

National Testing Agency

Narayan Waikar **Authorised Officer** Pune Sahakari Bank Ltd.

undlass Stoodberg vo.

and 205/K1, Area 531 sq.feet (North East 14'.10'

x East West 24'.23") constructed in stone bricks


and plaster and roof of cement. Towards East

Property of Shri Shivaji and MarutiAbaji Mate

Towards South: Property of Harishchandra N

Mate and road, Towards West : Property of

VithobaSopana Mate, Towards North: Proerty of



The National Testing Agency (NTA) has been established by Ministry of Education, Govt. of India, as an independent/autonomous, self-reliant, and self-sustained premier testing organization.

IIFT MBA(IB) 2022-24 Entrance Examination

The Indian Institute of Foreign Trade (IIFT), established in 1963 by Ministry of Commerce and Industry, Govt. of India is one of the top business schools in the country renowned for skill building in the external trade sector of the India. The Institute is also a Category-I deemed to be university.

NTA will be conducting Computer Based Test for admission to IIFT-MBA (International Business) 2022-24 programme as per details given below:

Date of exam	5 December 2021(Sunday) 10.00 am to 12.00 noon				
Mode of xam	Computer Based Test (CBT)				
Pattern of exam	Multiple Choice Questions				
Exam centres	Exam will be conducted in 68 cities across India.				
Eligibility	Recognized Bachelor's degree of minimum 3 years' duration in any discipline with 50% marks in Graduation (45% for SC/ST/PwD candidates). Candidates appearing in the final year examination of Graduation can also apply. There is no age limit.				
Reservations	Reservation for SC/ST/OBC(NCL)/PwD/EWS/Kashmiri migrants as per Govt. of India rules.				
For Foreign Nationals & NRIs	Seats are reserved for Foreign Nationals & NRIs and the admission is considered on the basis of GMAT score and Interview.				
Submission of Online Applications Form & From 02.09.2021 to 15.10.2021 From 15.01.2022 to 15.03.2022 (For NRIs and Nationals)					

Others details such as Eligibility, Scheme of Exam, duration, intake, reservation, application fee, list of exam cities, important dates, admission procedure etc are contained in the Information Bulletin hosted on https://iift.nta.nic.in . Candidates who are desirous of applying may go through the Information Bulletin and apply online only at https://iift.nta.nic.in and also pay the applicable fee online during the period from 02.09.2021 to 15.10.2021 using Debit Card/Credit Cards/Net Banking/Paytm. For any clarifications, candidates can call NTA Help Desk at 011-40759000 or write to NTA at iiftmba-ib@nta.ac.in.

davp 21354/11/0012/2122

Dr. Sadhana Parashar Senior Director (Exams)

GALAXY AGRICO EXPORTS LIMITED

REGD. OFF / Factory : Jaikishan Ind. Estate, Survey No. 236, B/H Murlidhar Weigh Bridge, Veraval (Shapar). Dist. Rajkot. Tel. 02827-252676 Fax: 02827-254371 E-mail: info@galaxyagrico.com Web: www.galaxyagrico.com CIN: L01110GJ1994PLC021368

NOTICE OF AGM, E-VOTING AND BOOK CLOSURE

NOTICE is hereby given that 27" Annual General Meeting (AGM) of Members of the Company will be held on Thursday, 30° September, 2021 at 11.00 a.m. At 236 Jai Kishan Industrial Estate, Behind Murlidhar Weigh Bridge, Veraval-Shagar (360024) Gujarat (India) to transact the ordinary and special businesses mentioned in the notice as contained in the Annual Report of the Company for the Financial Year 2020 - 21. Members of the Company are hereby informed that the Company has completed the dispatch of Notice of the AGM. As per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and

Administration) Rules, 2014, and amendments thereto and Clause 358 of the Listing Agreement, the Company is pleased to provide its Members the facility to cast their vote electronically, through the remote e-voting services provided by Central Depositary Service Limited (CDSL), on all resolution set forth in the Notice. The date of completion of dispatch of Notices is 04" September, 2021. The Company has sent e-mail through COSL along with details of Login ID and Password to the Members whose e-mail ids are available with the Company or have been provided by the Depositories.

Pursuant to the 20 of the Companies (Management and Administration) Rules, 2014 and amendments thereto, the Members are provided with the following Information:

1.The remote e-voting period commences on Monday 27" September, 2021 (9:00 a.m. IST) and ends on Wednesday 29" September, 2021 (5:00 p.m. IST). Remote e-voting by electronic mode shall not be allowed beyond 5:00 p.m. IST on 29" September, 2021. The voting rights of the members, entitled to participate in the remote e-voting process shall be in proportion to their share in the paid up equity share capital of the company as on the cut-off date i.e. Thursday, 23" September, 2021.

2. Any person, who acquires shares of the Company and become member of the company after dispatched of the notice and holding shares as of the cut-off date i.e. Thursday 23" September, 2021, may obtain the login ID and Password by sending a request at evoting/Scdsl.co.in or RTA of the Company. However, if a person is already registered with COSL for e-voting, then existing user ID and password can be used for casting vote.

3.The Members are also informed that: a. The facility for voting through ballot paper shall be made available at the AGM and the members attending the meeting who have not cast their vote by remote e-voting shall be able to excersice their right at the meeting t brough ballot paper.

b. The members who have cast their vote by remote e-voting prior to the ASM may also attend the ASM but shall not be entitled to cast their vote again in the meeting.

c. A Member as on the cut-off date shall only be entitled for availing the Remote e-voting facility or vote, as the

case may be, in the AGM. d. A person, whose name is recorded in the register of the members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avial the facility of remote e-voting /

Voting at the AGM through ballot paper. 1. The Notice of the AGM, along with the procedure for remote e-voting, has been sent to all the members by prescribed modes and the same is also available on the website of the company at www.gataxyagrico.com and on the website of National Securities Depository Limited at https://www.evoting.cdsl.com 2.In case of gueries/grievances connected with e-voting, Members/Beneficial owner may contact CDSL: Mr. Nilesh Dalwadi, email: ahmedabad@linkintime.co.in, Phone No.: (079) - 2646-5179. or Members may contact Mr. Manoj Shah (Whole time Director) at the Registed Office of the Company at Jai Kishan Industrial Estate, Behind Murlidhar Weigh Bridge, Veraval-Shapar (360024) Gujarat (India) Phone: 02827-252676, email: mike@galaxyagrico.com M/s H. B. Kalaria & Associates, Chartered Accountant, Rajkot has been appointed as Scrutinizer for conducting the

remote e-voting process in a fair and transparent manner. Further notice is hereby given that pursuant to provisions of section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Clause 16 of the Listing Agreement. Register of Members and Share Transfer Books of the Company will remain closed from Thursday September 23, 2021 to Thursday, September 30, 2021 (Both days inclusive) for the said AGM of the Company. A member entitled to attend and vote at the meeting is entitled to appoint proxy to attend and vote on a poli instead of him/her and the proxy need not be a member of the company. The instrument appointing groxy should however be deposited at the registered office of the company not less than forty-eight hours before the

Place: Rajkot

commencement of the meeting. By Order of the Board, **GALAXY AGRICO EXPORTS LIMITED** Date: 04-09-2021 Manoj Harsukhlal Shah

WHOLE-TIME DIRECTOR DIN: 02173383 管

Ahmedabad financialexp.epapr.in

રાજ્યમાં કોરોનાના કેસમાં ૬૦ટકાનો ઉછાળો, ૧૬ કેસનો ધાયા

આવ્યા ન હતા અને આજે અચાનક વિતેલા 24 કલાક દરમ્યાન દસ

રાજ્યમાં હજુ પણ ૧૪૯ એક્ટિવ કેસ સુરત, અમદાવાદ અને વડોદરામાં ૪-૪ કેસ નોંધાયા, ભાવનગરના દર્દીનું મોત

3 કોરોનાના કેસો નોંધાવા પામ્યા છે. દિવસ બાદ ગુજરાતમાં ભાવનગર

છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોના 17 ખાતે કોરોનાથી 1 મૃત્યુ નોંધાવા

દર્દીઓ સાજા થવા પામ્યા છે. ભાવનગર, પામ્યું છે. આમ કોરોનાથે થયેલા

ગાંધીનગર, જુનાગઢ, જામનગર અને મૃત્યુનો આંક 10082 થયો છે.

રાજકોટ મનપા સહિત અન્ય 30

डेनरा जेंड Canara Bank 📣

Titles Syndicate

સુધારો

ા. ૧૭.૦૮.૨૦૨૧ના રોજ ગુજરાત ગાર્ડિય

ર્તમાન પત્રમાં **શ્રી અન્તુર્સીંગ અદર, ભાદર અને**

તા. ૧૧.૦૮.૨૦૨૧ની કબજા નોટીસમાં શાખાન

गम **संकी काने आयुकास शामाने अहसे हेन**

वारीण : ०४.०६.२०२२ थडीर्- अधिकृत अधिकारी, स्थल : समस्यायाद

સુધારો

આથી લાગતા વળગતાઓન

ધ્યાન દોરવાનું કે તા.૧૩-૦૮

२०२१ना गुणरात गार्डियन

દૈનિકમા 'ટાઇટલ ક્લીચરન્સ'ની

જાહેરાત પ્રકાશીત કરવામાં આવી

છે તેમજ પહેલા પક્ષના લખાવી

तेनार **नीतिनभाधना पितानुं**

નામ ગોવિંદભાઇ સુમરા છપાર્યું

છે તે સુધારી જેસીંગભાઇ સુમરા

ઁવિતેલા 24 કલાક દરમ્યાન

કલાક દરમ્યાન ગતરોજ કરતા 60 ટકા દરમ્યાન ગજરાતમાં 16 કોરોનાના

મોજે ભુવાસણ, તા.બારડોલી, જિ.સુરત મુકામે બ્લોક સરવે નં.૨૨७થી નોંધાચેલ કુલ જમીન પૈકીની બીનખેતીની (બીનખેતી - બલુહેતુક ઉપયોગ) થચેલ ૩૦૧૧૧ ચો.મીટર જમીન અંગે ટાઈટલ ક્લીચરન્સ અન્વચેની જાહેર નોટિસ

આથી તમામ લાગતા વળગતાઓને હાલની આ જાહેર નોટિસથી જણાવવાનું કે, સ્કાયવીન પર ઈન્ડરટ્રીઝ પ્રા.લિ.ના ડિરેક્ટરશ્રીઓ મુ.પો.ભુવાસણ, તા.બારડોલી, જિ.સુરત મુકામે આવેલ भुवासण पाते नोंघायेल ज्लोङ / सरवे नं रर७ अने पाता नं २०६ वाजी मिलङत सने १८७६ . અગાઉથી (૧) શ્રી છીતા વલ્લભભાઈ, (૨) મગન વલ્લભ તથા (૩) સ્તન વલ્લભ નાઓના સંયુક્ત નામે ચાલી આવેલ. ત્યારબાદ છીતા વલ્લભનાં વારસો ઠાકોર છીતા, જયંતિ છીતા તથા મરહૂમ રતન વલ્લભના સીધી લીટીના કાયદેસરનાં વારસો જીણીબેન તે સ્તન વલ્લભની વિધવા વગેરે (૮) નાઓએ સદર જમીન ભારકરભાઈ નાનુભાઈ દેસાઈ વગેરે (૪) નાઓને રિજસ્ટર્ડ દસ્તાવેજ નં.ર93૦/૨૦૦૫થી વેચાણ કરેલ. જેની રેવન્યુ રેકર્ડ દફતરે વેચાણ અંગેની ફેરફાર નોંદા ૨૦૮૧ પાડવામાં આવેલી જે નીંદ્ય ટેકનીકલ કારણોસર સક્ષમ અધિકારી મામલતઘર ઓફિસ બારડોલી દ્વારા તા.૩-૪-૨૦૦૬ના અસ્સામાં ૨૬ કરવામાં આવતાં, સદર જમીન ઉપરોક્ત જણાવેલ મૂળ માલિકના નામે ચાલી આવેલ. ત્યારબાદ સદર નોંધ રદ કરવાના કારણે તથા કેટલાક કારણોસર સદર જમીનનો વેચાણ વ્યવહાર રદ કરવા બાબતે કેન્સલેશનનો યાને કે રદીકરણનો રજિસ્ટર્ડ દસ્તાવેજ નં.૧૧૦૯/૨૦૧૫ર્થ . કરવામાં આવેલો. ત્યારબાદ ઠાકોરભાઇ છીતાભાઇ. જયંતિભાઇ છીતાભાઇ મરહમ રતન વલ્લભન વારસો, મરહૂમ વજયાબેન રતનજીના વારસો, મરહૂમ અમૃત રતનજીના વારસો તથા મરહૂમ ચંદ્રકાંત રતનર્જીના વારસો મળી કુલ ૧૩ ઈસમોએ સર્દર ઉપરોક્ત જમીન દેવાંગકુમાર દિનેશચંદ્ર પેટેલ વગેરે ત્રણનાઓને વેચાણ કરેલ છે. જે વેચાણ અંગેની ફેરફાર નોંધ નં.૨૪૩७ પાડવામાં આવેલી. જે નોંધ પ્રમાણિત થતાં શ્રી દેવાંગફુમાર દિનેશચંદ્ર પટેલ વગેરે શ્રણનાઓ સદર જમીનના સંયુક્ત માલિક બનેલા. તેઓએ સદર કુલ ખેતીની જમીન પૈકી ૩૦૧૧૧ ચો.મીટર જમીન અંગે મહેરબાન કલેકટરશ્રી સુરતના હુકમ નં.૧/૨૨/૧૨/૦७/૨૦૨૧થી સદર જમીન સંબંદો બીનખેતીના બહુહેતુક ઉપયોગ હેતુસર ર્કેપયોગ કરવા બાબતેનો હુકમ કરેલો. જે અન્વયેની નોંદા નં.૨૫૯૯ કરવામાં આવેલ. ત્યારબા શ્રી દેવાંગકુમાર નિદેશચંદ્ર પટેલ વગેરે ગ્રણ નાઓ પાસેથી અનુક્રમે રિજસ્ટર્ડ વેચાણ દસ્તાવેલ નં રપર/૨૦૨૧ તથા ૨૫૩/૨૦૨૧થી સદર બીનખેતીની જમીન રકાયવીન પેપર ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.ન ડિરેક્ટરો શ્રી અમૃતભાઈ રાઘવજી કાસુન્દ્રા વગેરે ૪ નાઓ પાસેથી ખરીદ કરી જે અંગેની રેવન્થુ રેકર્ડ દક્તરે વેચાણ અંગેની ફેરફાર નોંધ ને સ્દૃ૦૩, તા.૮-૩-૨૦૧૧ તથા ૨૬૦૬ તા.૧૯-૩-૨૦૦૧થી સદર જમીનના માલિક થયેલા હોવાનું તથા સદર જમીન મહિ પેપર મીલ હેતુ સંબંદો બાંઘકામ કરવાની ગ્રામ ર્પચાચત ભુવાસાયના કરાવ ન ૨૦૦૦, તા ૧૨-૯-૨૦૨૧થી બાંદાકામ કરવાની પરવાનગી મળેલ હોવાનું જણાવી, સદર બીનખેતીની જમીન અન્વચે હમો પાસેથી ટાઇટલ ઇન્વેસ્ટીગેશન રિપોર્ટ ચાને કે ટાઇટલ કલીયરન્સ સર્ટિફિકેટની માંગણી કરેલ હોય, સદર જમીન સંબંધે કોઈ પણ રાષ્ટ્રિયકૃત બેંક, સરકારી ઝેંક, ખાનગી યાને પ્રાઈવેટ નાણાકીય સંસ્થા, ફૂબ્રિમ વ્યક્તિ, પેઢી કે અન્ય કોઈ પણ વ્યક્તિઓને કે કોઈપણ સંસ્થાનો પ્રત્યક્ષ કે પરોક્ષ યાને ડાયરેકટ યા ઈનડાયરેકટ પ્રકારનો ચાર્જ, બોજો, લીયન, લાગભાગ હક-હિસ્સો, કબબો, વપરાશી હકક, ટેનન્સી રાઈટસ, દર-દાવો, ભરણપોષણ વગેરે હોય તો તેઓએ હાલની નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન સાતમાં દસ્તાવેજી પુરાવા સહીત લેખિતમાં જાણ કરવી જો મુદત વિત્યે કોઈના કોઈપણ પ્રકારના સદર જમીન સંદર્ભે વાંદા-વચકા, તર-તકરાર આવશે નહી તો સંદર જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક-હિસ્સો, દર-દાવો ન હતો કે નથી અને જો હોઈ તો તેવા તમામ પ્રકારના અધિકાર સંપૂર્ણ રીતે જતા કર્યા છે. યાને કાયદેસર રીતે વેવ કર્યા છે. અને કોઈ પણ વ્યકિત અગર સંસ્થા સમક્ષ સંદર મિલકત ઉપર બોજો ઉત્પન્ન કરવામાં આવેલ નથી, એવું માની લઇ ટાઈટલ ઇન્વેસ્ટીગેશન રિપોર્ટ યાને કે ટાઈટલ કલીયરન્સ સર્ટિફિકેટ ઈસ્ટ્ કરવામાં આવશે, ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તર-તકરાર કે વાંદા વિરોદ્ય ચાલશે નહિ, જેની લાગતા વળગતાઓએ નોંધ લેવી. તા.૦૧-૦૯-૨૦૨૧

સુધીર શરદ સુળે (એડવોકેટ અને નોટરી) ઓફીસઃ ૧૦૨- ગોવિંદ ભુવન, સુળે કોમ્પલેક્ષ, સચાજી વેભવ લાયબ્રેરી સામે, નવસારી



हेग्गत वैक Canara Bank अर्थ शोधिंग केन्द्रर, अंक्षिक जिंदेतन गेटनी पासे, पास्त्रे पोर्डन्ट, अंदिक जिंदेतन गेटनी पासे, पास्त्रे पोर्डन्ट, सुरत - उक्प००७.

परिशिष्ट - २० प्रजेशन नोटीस (७४० - २३(४) (स्थापर भिषकत आहे)

આથી નીચે સહી કરનાર કેનેરા ભેંક ના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, ૨૦૦૨ (૫૪ ઓફ ૨૦૦૨) (ત્યાર બાદ એકટ તરીકે ઓળખાય છે) તથા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ સહિત કલમ ૧૩(૧૨) અંતર્ગત મળેલ સત્તાની રૂએ તા. ૧৯.૦૫.૨૦૨૧ ના રોજ ઉધારકર્તા શ્રી હરીયતુમાર બાબુલાલ રોન (ઉદારકતા) તેમનો એકાઉન્ટ ને. ૧૧૦૦૯૮૩૦૦૦૦૦૬૧ ને જારી કરીને નોટીસમાં જણાવેલ રૂા. ૬,૨૪,૩૬૧.৬૨ (રૂા. છ લાખ થોવીસ કલાર ત્રણસો એકસક અને બ્રોનેર પૈસા પુરા) વત્તા તા. ૧૭.૦૫.૨૦૨૧ ના રોજ થી ચડત વ્યાજ અને અન્ય ખર્ચાઓ સાથે ૯૦ દિવસની અંદર બાકી રકમ સહિત ચક્કવા જણાવેલ.

ઉપારકર્તા ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તા તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમની કલમ ૧૩ ની પેટા કલમ (૪) તથા ઉક્ત નિયમો હેઠળના નિયમ ૮ અને ૯ અંતર્ગત મળેલ સત્તાની રૂએ અધોહસ્તાશરકર્તાએ મિલકતનો તા. os.oe.રoર૧ ના રોજ નિય્નલિખિત મિલકતનો મત્યભ કળવો લઇ લીધો છે.

ઉધારકર્તાને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલકત અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ મિલકત અંગે કરેલો કોઈપણ વ્યવહાર કેન્નેશ ભેંઠ ની રકમ રૂા. 9,૫૦,૧૮૯.૭૯ (રૂા. છ લાખ સત્તાવન હજાર એક્સો નેવ્યાસી અને ઓઝશાએસી પૈસા પુરા) તો. 31.0૮.૨૦૨૧ ના સુધી અને ચડત વ્યાજ અને અન્ય ખર્ચાઓ સાથેના બોજા સહિત રહેશે.

"સરફેસી કાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે મુકરર ઉધારકર્તાઓને મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે."

स्थापर भिस्कतर्नु पर्शन

સ્થાવર મિલકતની દુકાન નં. એ/૧૪ (ગ્રાઉન્ડ કલોર), જેનું ક્ષેત્રફળ ૨૧૫.૩૦ સ્કે. ફીટ., અવિભાજીત હકક સાથે, સાંઈ શ્રુષ્ટિ રેસીડેન્સી નં. એ થી જાણીતી બિલ્ડીંગ, જમીનનો બ્લોક નં. કર થી કલ અને ૮૯, સંયુક્ત ન્યુ બ્લોક નં. ૧૩, ટીપીએસ નં. ૧૯, એફ.પી. નં. ૪/એ, મંજુર થયેલ પ્લાન મુજબ સબ પ્લોટ નં. ૨, જેનું ક્ષેત્રફળ ૨૩૯૨ સ્કે.મી., જે સ્થિત ગામ - ગોડાદરા, સબ જીલ્લો - ચોર્યાસી, સુરત. <mark>અતુઃસીમા</mark> :- **પૂર્વે** : જોડેનો રોડ, પશ્ચિમ : જોડેની બિલ્ડીંગ નં. બી, કતા≹ : જોડેનો રોડ, દક્ષિણે : જોડેની સોસાયટી. સ્ક્રી/-, અધિકૃત અધિકારી, કેનેરા બેંક तारीज : ०३.०६.२०२१, २६०१ : सुरत

क्रीन नं. ०ँर६३७-रेप९४४३, भोजाधल नं. ९८२५०९०९५०

परिशिष्ट - ९० च्छेशन नोटीस (७०म - ९३(४) (स्थापर भिलकत भाटे)

केमरा बैंक Canara Bank विशेषक केम कार्यकार कार्यकार केम कार्यकार केम कार्यकार केम कार्यकार केम कार्यकार केम कार्यकार कार्यकार केम कार्यकार केम कार्यकार केम कार्यकार केम कार कार्यकार कार्यकार कार्यकार कार्यकार कार्यकार कार्यकार कार्यकार क

ता.३१-०८-२०२१ | स्थणः सस्त

આથી નીચે સહી કરનાર **ક્રૅનેટા બૅઠ** ના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, ૨૦૦૨ (૫૪ ઓફ ૨૦૦૨) (ત્યાર બાદ એક્ટ તરીકે ઓળખાય છે) તથા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ સહિત કલમ ૧૩(૧૨) અંતર્ગત મળેલ સત્તાની રૂએ તા. ૦૫.૦૪.૨૦૨૧ ના રોજ ઉધારકર્તા **લી સંજીવ** સતિષર્ચંદ્ર શર્મા (ઉદ્યારકર્તા) અને એસ્લ સંજીવસુમાર શર્મા (સહ-ઉદ્યારકર્તા) તેમનો એકાઉન્ટ ને. ૧૧૦૦૦૦૦૦૧૪૮૪ ને જરી કરીને નોટીસમાં જણાવેલ રૂા. ૧૩,૦૪,૦૪૫.૩૪ (રૂા. તેર લાખ સુંગોવેર કબર પિસ્તાલીસ અને છત્રીસ પૈસા પુરા) વત્તા તા. ૨૯.૦૨.૨૦૨૦ ના રોજ થી ચડત વ્યાજ અને અન્ય ખર્ચાઓ

સાથે ૯૦ દિવસની અંદર બાકી રકમ સહિત ચુકવવા જણાવેલ. ઉધારકર્તા ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આવી ઉધારકર્તા તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમની કલમ ૧૩ નો પેટા કલમ (૪) તથા ઉક્ત નિયમો હેઠળના નિયમ ૮ અને ૯ અંતર્ગત મળેલ સત્તાની રૂએ અધોહસ્તાશરકર્તાએ મિલકતનો તા. ૦૧.૦૯.૨૦૨૧ ના રોજ નિમ્નલિખિત

ઉધારકર્તાને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલકત અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ મિલકત અંગે કરેલો કોઈપણ વ્યવહાર **કેતેરા લેંક** ની રકમ રૂા. ૧૫,૫૧,৬૪৬.૨૮ (ફા. પંટર વાખ એકાવન કબાર સાતસો શક્સઠ અને અઠયાવીસ પૈસા પુરા) તા ૩૧.૦૮.૨૦૨૧ ના સુધી અને વ્યાજ સાથેના બોજા સહિત રહેશે.

"સરફેસી કાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે મુકરર ઉધારકર્તાઓને મિલક્ત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે."

(૧). સંજીવ સતિષચંદ્ર શર્મા, (૨). ગોરલ સંજીવ શર્માના નામની સ્થાવર મિલકતનો ફ્લેટ નં. ૪૦૯ (ચોથો માળ) જેનું ક્ષેત્રફળ ૯૧.૦૪ સ્કે.મી., અવિભાજીત હક્ક સાથે નું ક્ષેત્રફળ ૨૮.૫૬ સ્કે.મી., સાંઈ રેસીડેન્સી નં. બી થી જાણીતી બિલ્ડીંગ, તમામ સુવિધાઓ સાથે, જમીનનો આર. એસ. નં. ૧૨૫/૧, બ્લોક નં. ૧૯૭, ટી.પી. સ્ક્રીમ નં. ૧૯ (ડીંડોલી), એફ.પી. નં. ૧૬૬ અને જે સ્થિત ગામ - ડીંડોલી, જીલ્લો સુરત, સબ જીલ્લો - સુરત. **અતુઃ સીમા** :- પૂ**ર્વે** : સાંઈ રેસીડેન્સી બિલ્ડીંગ નં. સી, પશ્ચિમે : સાંઈ રેસીડેન્સી બિલ્ડીંગ નં. એ, ઉત્તરે : બિલ્ડીંગ નં. બી ની સોસાયટીનો રોડ, દક્ષિણે : ૧૫ ફુટ પહોળી જગ્યા પાછળ છોડી બ્લોક નં. ૧૯૮.

તારીખ : ૦૧.૦૯.૨૦૨૧ **अधिकृ**त अधिकारी,

વખતથી ભાવનગરમાં કોરોનાના કેસો કેસ છે જે પૈકી પ વેન્ટિલેટર પર છે. અને 1 કેસ મહિસાગર જિલ્લા સિવાય નોંધાયા નથી.

સુધારા અંગેની જાહેર નોટીસ

અમોએ તા.oc/os/૨૦૨૧ના રોજ ટાઇટલ ક્લીયરન્સ અંગેની જાહેર નોટીસ આપેલી જે નોટીસમાં ખોવાય ગયેલ દસ્તાવેજની વિગતમાં મોજે ગામઃ કનસાડ, તાલુકો : ચોર્યાસી, જીલ્લો ગારાના ખાવાય ગયલ દરદાલિયા વિગાના મુખાન કળાને કળારોક, તાલુકા . યાંચારા, છુલા : સુરત વાળી મિલકતને લાગતી દરતાવેજ જેનો અનુક્રમ નંબર ૨૪૦૦ (ડુપ્લીકેટ કોપીની) તા.૨૩/૧૦/૨૦૧૦ ના રોજ નોંધાયેલ રજીસ્ટ્રેશન કી ભર્યાની અલસ પાવતી શરત ચુકથી લખવાનું રહી ગયેલ છે જે અંગેની આ યુધારાની નોટીસ આપીએ છીએ જો તેની સામે કોઇને પણ કોઇપણ જાતના વાંધા, વિરોધ, અવરોધ, અટકાયત હોય કે દરદાવો, ચાર્જ બોજા કે લીયનના હક્કો નોંધાયેલા હોય તો દિવસ-પ માં અમારા નીચે જણાવેલ સરનામે આવી પુરાવા સહિત નોંધાવી જवा को उपरोड्त मुद्दतमां ङोछना ङोछपए कातना वांधा आवशे नहीं तो तेमणे पोताना तमाम હક્ક હિરસો જતો કર્યો છે તેમ માની સદરહુ મિલકતનો ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ ઇસ્યુ કરવામાં આવશે અને પાછળથી કોઇના પણ કોઇપણ જાતના વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં

રાજકોટ મનપા સહિત અન્ય 30 વિતેલા 24 કલાક દરમ્યાન જિલ્લામાં કરોનાના એક પણ કેસ નોંધાયા નોધાયેલા 16 કેસમાં અમદાવાદ, સુરત સરનામું :- બી/૩૦૬, તિરૂપતી પ્લાઝા, બહુમાળી બિલ્ડીંગ પાસે, અઠવાગેટ, સુરત. ફોન. ૨૪७٩૧૪૪

કામરેજ ચાર રસ્તા શાખા, ગામ નવાગામ, નવસર્જન સોસાયઢી પાસે, તા. કામરેજ, જિ. સુરત. ફોન : 02621-255600, 253600 ઈ-મેલ : kamrej@bankofbaroda.com



સાંકેતિક કબજા નોટીસ (સ્થાવર મિલકત)

માથી નીચે સહી કરનાર બેંક ઓફ બરોડાના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ

આવા નાય તહે કરતાર એક અધ્યુ ગયા સિક્યુસીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002ના નિયમ 3 સહિત કલમ 13(12) અંતર્ગત મળેલ સત્તા હેઠળસદર નોટીસમાં પાઠવેલી ટકમ અને આગળના વ્યાજસાશની બાકીરકમસદરહુ નોટિસ મળ્યાની તારીખર્શી 60 દિવસમાં પરત ચુકવા જણાવાયું હતું. કરજદાર/મોર્ટગેજર સદરહુ રકમ પરત ચુકવવામાં નિષ્ફળ જતા કરજદાર/મોર્ટગેજર અને જાહેર જનતાને આ સાથે નોટિસ આપવામાં આવે છે કે સહી કરનારે સદરહુ ઓર્ડીનેન્સ એક્ટરની કલમ 13(4) અને સિક્યુસીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમ 2002ના નિયમ 8 સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ અહીં નીચે જણાવેલી મિલકતનો સાંકેતિક કબજો તા. 31-ાહીં કરજદાર/મોર્ટગેજરનું ધ્યાન દોરવામાં આવે છે કે, જ્ણાવેલ સમય મર્યાદામાં સેક્શન 13ના સબ સેક્શન (8) હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતોને બાકી લેણા ભરપાઈ કરી

કરજદાર/મોર્ટગેજર અને જાહેર જનતાને આથી જાહેર ચેતવણી આપવામાં આવે છે કે, તેમણે સદરહુ મિલકત ભાબતમાં કોઈ વ્યવહાર કરવો નહીં અને કોઈપણ **બેંક ઓફ બરોડા,**

	to der ari fare ner nen ne		DECEMBER DE LE LIEU DE LE
ક્રમ	દેવાદાર/જામીનદાર/ મોર્ટગેજરનું નામ	ડિમાન્ડ નોટીસની તારીખરમને સ્ક્રમ	મિલકતની વિગત
L	શ્રી દિપકભાઈ ખોડાભાઈ દેવાની (કરજદાર), શ્રીમતી કાજલબેન દિપકભાઈ દેવાની (સહ-કરજદાર)	રૂા.10,23,916.10 અને તેના ઉપરનું વ્યાજ ઉપરાંત રીવર્સલ વ્યાજ	તમામ હક્ક અને ઈન્ટરેસ્ટ સાથે ક્લેટ નં. 104, બિલ્હીંગ નં.B/2 પૈકી માન્ય પ્લાન પ્રમાણે એટલે કે ક્લેટ નં.101, બિલ્હીંગ નં.A/9, સાઈટનું અંદ્રાજીત માપ 573.07 ચો. ફુટ એટલે કે 53.26 ચો.મી. પહેલા માળે બંધાયેલ, "ઓમ ટાઉનશીપ વિભાગ-5", કથિત બિલ્હીંગની જમીનમાં અવિભાજીત પ્રમાણસર હિસ્સા સાથે માપ 40.26 ચો.મી., રેવન્યુ સર્વે નં.138/1C, 138/2, 138/1/B, 137/3, 136/2, 136/1 એટલે કે બ્લોક નં. 182, 184, 185, 186, 188 અને 189, ગામ પાસો6રા, તા.કામરેજ, જી.સુરત.
2.	શ્રી વિપુલભાઈ કાનજીભાઈ ડોંડા, શ્રીમતી દયાબેન વિપુલભાઈ ડોંડા, શ્રી કાનજીભાઈ વાયજીભાઈ ડોંડા, શ્રી દિપેશભાઈ ભગવાનભાઈ ખડેલા (જામીનદાર)	al, 09-09-2019	તમામ ભાગ અને હિસ્સા સહિત મિલકત, ફ્લેટ નં.504, પાંચમો માળ, અંદાજીત આશરે માપ 40.18 ચો.મી., કથિત બિલ્ડીંગમાં અવિભાજીત પ્રમાણસર હિસ્સા સાથે, "ઓપેરા પેલેસ" નં.D/4, તેને લગતી તમામ અનરૂપતા સાથે, રેવન્યુ સર્વે નં.135, લ્લોક નં.331/A, 331/B/1 અને 331/K, એક્ઝીકરણ બ્લોક નં.331/A, ટી.પી. નં. 47 (કોલવાડ-ભાડા), ફાઈનલ પ્લોટ નં.89/A, ગામ ખોલવડ, તા.કામરેજ, જી.સુરત. જે મિલક્ત શ્રી વિપુલભાઇ કાનજીભાઈ ડોંડાના નામે સ્થિત છે. જેની ચતુર્સિમા : ઉત્તરઃ સોસાયટીનો રસ્તો, દક્ષિણ : બિલ્ડીંગ નં.C-4, પૂર્વ : બિલ્ડીંગ નં.D-5, પશ્ચિમ : બિલ્ડીંગ નં.D-3.

જે. એસ. પટેલ, મુખ્ય પ્રબંધક, અધિકૃત અધિકારી, બેંક ઓફ બરોડા.

केनत के 🗱 Canara Bank

સુરત પારશે પોઇન્ટ શાખા : સમર્થ શોપિંગ સેન્ટર, અંડિક્કા નિકેતન ગેટની પાસે, પારશે પોઇન્ટ, સુરત - ૩૯૫૦૦૯.

परिशिष्ट - ९० **प्रजेशन नोटीस** (क्कम - ९३(४) (स्वावर मिबरुत मार्टे)

આથી નીચે સહી કરનાર કેનેટા ભેંક ના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન બોક કાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્કોર્સમેન્ટ ઑક સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, ૨૦૦૨ (૫૪ ઓક ૨૦૦૨) (ત્યાર બાદ એકટ તરીકે ઓળખાય છે) તથા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ સહિત કલમ ૧૩(૧૨) અંતર્ગત મળેલ સત્તાની રૂએ તા. ૦૫.૦૪.૨૦૨૧ ના રોજ ઉધારકર્તા શ્રી विपुत्तकुभार वावरक्ष्मार्थ कुरुडीया (भोभाईटर, र्थशु ट्रेन्डअ) तेभनो स्नेशर्डन्ड नं. ४९४४९४००००३५४ અને ૧૧૦૦૦૦૦૩૭૮ ને જારી કરીને નોટીસમાં જણાવેલ ફા. ૨૦,૦૯,૧૯૧.૪૦ (ફા. સત્યાવીસ લાખ નવ હજાર પાંચસો એકાસું અને ચાલીસ પૈસા પુરા) એકાઉન્ડ નં. ૦૧૦૦૧૪૦૦૦૦૩૬, તા. ૩૧.૦૩.૧૦૧૧ ના રોજ સુધી અને એકાઉન્ડ નં. ૦૧૦૦૦૧૦૦૦૩૬૮, ફા. ૧,૩૯,૩૦૦.૯૬ (ફા. એક **લાખ ઓગામચાલીસ હજાર ગણસો અને છજ્ન પૈસા)** વત્તા તા. ૩૧.૦૩.૨૦૨૧ ના સુધી, ચડત વ્યાજ, આકસ્મિક ખર્ચાઓ, કોસ્ટ વગેરે સાથે ૧૦ દિવસની અંદર બાકી રકમ સહિત ચુકવવા જણાવેલ.

ઉધારકર્તા ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તા તથા જાહેર જનતાને નોટીસ માપવામાં આવે છે કે અધિનિયમની ક્લમ ૧ ૩ ની પેટા ક્લમ (૪) તથા ઉક્ત નિયમો હેઠળના નિયમ ૮ અને ૯ અંતર્ગત મળેલ સત્તાની રૂએ અધોહસ્તાક્ષરકર્તાએ મિલકતનો તા. ૦૧.૦૯.૨૦૨૧ ના રોજ નિમ્નલિખિત મિલકતનો કબજો લઇ લીધો છે.

ઉધારકર્તાને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલકત અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવશ્રી આપવામાં આવે છે. સદરહુ મિલકત અંગે કરેલો કોઈપણ વ્યવહાર હેન્નેરા <mark>બેંક</mark> ની રકમ **રૂ**દ રષ્ઠ,૦૬,૫૬૧.૪૦ (અંકે સત્યાવીસ લાખ નવ હજાર પાંચસો એટાણું અને ચાલીસ પૈસા પુરા) એટાઉન્દ નં. હ૧૬૯૧૪૦૦૦૦૩૬૯, તા. ૩૧.૦૩.૨૦૨૧ ના સુધી, એટાઉન્ટ નં. હ૧૯૯૯૧૦૦૦૦૩૬૮, રૂા ૧,૩૯,૩૦૦.૯૬ (અંકે એક લાખ ઓગક્યાલીસ હજાર ત્રક્ષસો અને છજ્ઞુ પૈસા પુરા) તો. ૩૧.૦૩.૨૦૨૧ ના સુધી, ચડત વ્યાજ અને આકસ્મિક ખર્ચાઓ અને કોસ્ટ અને વ્યાજ સાથે ના બોજા સહિત રહેશે.

"સરફેસી કાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે મુકરર ઉધારકર્તાઓને મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે."

પ્લોટ નં. ૧૯, એરીયાનું ક્ષેત્રફળ ૪૨૦ સ્કે. ફીટ., લક્ષ્મીનગર સોસાયટી, ટી. પી. સ્કીમ નં. ૨૧, બ્લોક નં. ૧૦૭/બી, રેવન્યુ સર્વે નં. ૧૦૮/૧, ગામ - સરથાણા, તાલુકો - સુરત સીટી, જીલ્લો - સુરત. **લતુઃસીમા**ઃ **ઉત્તરે** : પ્લોટ નં. ૨૦, **દક્ષિણ** : પ્લોટ નં. ૧૮, **પૂર્વે** : પ્લોટ નં. ૧૦, પ**શ્ચિમે** : સોસાયટીનો રોડ.

તારીખ : ૦૧.૦૯.૨૦૨૧ અધિકૃત અધિકારી,

सेन्द्रल केंक्र ओक् इंक्टिया सेन्द्रल बेंक्र ओफ इंडिया CENTRAL RANK DE 18824 (\$544 मी. 908 थी. 907 2012 2015 CENTRAL BANK OF INDIA | PHZIR RIS, 30441 - 384000.

डीभान्ड नोरीस (सर्श्वेसी એક्ट, २००२ डक्म-९३

ની પેટા કલમ(૨) હેઠળ)

આથી નોટીસ આપવામાં આવે છે કે નીચેના ઉધારકર્તા **શ્રી નિવેશકુમાર શાંતિભાઇ પટેલ (ઉધારકતા**) તેમણે મેળવેલી વિરાણ સવલતો જેમ કે હાઉસીંગ લોન બેંક માંથી **શ્રી** *િલ્લેશકુમાર શાંભિભાર્થ પહેલ (ઉલાસ્કતા*) *ના* ગામે લીધેલ જેની મૂળ રકમ અને વ્યાજ ભરવામાં કસૂર કરેલ છે અને તેમની લોન નોન પરફોર્ચિંગ એસેટ (એનપીએ) વર્ગીકૃત કરવામાં આવી છે. તેમને નોટીસો સિક્યુરીટાઈઝેશન અને રીકન્સ્ટ્રકશન ઓફ કાયનાન્સીયલ એસેટ્સ અને એન્ફોર્સનેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ - ૨૦૦૨ ની કલમ ૧૩(૨) અંતર્ગત તેમના છેલ્લા અને જાશીતા સરનામા ઉપર પાઠવવામાં આવેલ પરંતુ તે "Laft" રીમાર્ક સાથે પરત થયેલ છે. તેથી આ જાહેર નોટીસ મારકતે જાશ કરવામાં આવે છે.

ઉ धारक्षतांनुं नाभ थाने सरनाशुं	ı
શ્રી તિલેશકુમાર શાંતિભાઇ પદેલ	Ť
(ઉદ્યાસ્કર્તા), પ્લોટ નં. ૨૦૬, શાંતિનગર	ı
સોસાયટી, સરથાણા જકાતનાકા ની પાસે,	ı
સરથાથા ગામ, જલ્લો-સુરત - ૩૯૫૦૧૩.	ı
શ્રીમતી કિરક્ષબેન મુકેશભાઇ ગજેરા D/o	ı
શાંતિવાલ ખોડાભાઈ પટેવ (જમીનદાર),	ı
એલ-૪૦૧, વેરોના રેસીડેન્સી, વ્રજ ચોકની	ı
પાસે, સિમાડા, સુરત - ૩૯૫૦૦€.	ı

शिरवे भुडेव भिवश्तनुं वर्धन કિરણબેન મુકેશભાઈ ગજેરાના નામની સ્થાવર મિલકતનો પ્લોટ નં. ૧૧૧ (મંજુર થયેલ પ્લાન મુજબ), જેનું શ્રેત્રફળ ૧૩૫.૮૭ સ્કે.મી. એટલે કે ૧૧૨.૪૪ સ્કે. યાર્ડ. એટલે કે ૧૪૧૨ સ્કે. ફીટ., અવિભાજીત હક્ક અને હિસ્સા સાથેના રોડ અને સીઓપી નું ક્ષેત્રફળ ૭૪૦.૭૫ સ્કે.મી., બી - પ્રકાર, "શ્રી ગોર્વધન ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપ્ડ "જમીન જે સ્થિત રાજય - ગુજરાત, જીલ્લો - સુરત, સબ જીલ્લો અને તાલુકો - માંગરોળ, મોજે -પીપોદરા, રેવન્યુ સર્વે નં. ૩૮૧, ૩૮૫ અને ૪૧૫, બ્લોક નં. ૩૮૫, બીન ખેતીલાયક જમીન પૈકી. ચતુઃસીમા :-ઉત્તરે : જોડેનો શેડ નં. ૧૧૨, દક્ષિણે : જોડેનો શેડ નં. ૧૧૦, પૂર્વે : જોડેનો શેડ નં. ૧૩૦, પશ્ચિમેં : જોડેની

(મોર્ગેજ ડીડ/દસ્તાવેજ ની વિગતો: કન્વેયન્સ ડીડ રજી. ડીડ નં. ૨૯૯૫, તા. ૧૧.૦૫.૨૦૧૫ ના રોજ

	8		થી	શ્રીમતી કિરણબે	ોન મુકેશભાઈ ગજેરાની	તરફેણમાં)	
Ш	बोबनो प्रकार	એકાઉન્ટ નં.	बोननी २५भ	व्याक्ष्मी हर	એनपीओ नी तारीफ	डीमान्ड नोहीसनी तारीण	कुस आही स्क्रम ता. २३.०५.२०२१
Ш	ය මේන්`න ශ් න	3466434468	15,00,000/-	% FE.OP	09.06.2020	75.05.20.25	3 Ⅰ. ૧७,3૧,૧૧૫/ -

નોટીસ બજવણી માટેના અન્ય પગલાં લેવાઈ રહયા છે ઉપરોક્ત ઉધારકર્તાને આથી આ નોટીસ પ્રસિધ્ધ થયાના ૯૦ દિવસની અંદર બાકી રકમની ચૂકવણી કરવા જજ્ઞાવવામાં આવે છે. તેમા કસૂર થતાં આ નોટીસની તારીખથી ૬૦ દિવસ પૂરા થયા બાદ સિકયુરીટાઈઝેશન અને રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિકયોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ - ૨૦૦૨ ની કલમ ૧૩ની પેટા કલમ (૪) મુજબ આગળ પગલાં ભરવામાં આવશે.

તારીખ : ૨૩.૦૬.૨૦૨૧, સ્વળ : સુરત अधिवृत अधिकारी, सेन्द्रव लेंक ओक् इन्डिया



CENTRAL BANK OF INDIA નાટાર રોડ, સુરત, જીલ્લો - સુરત - ૩૯૫૦૦૭.

डीभान्ड नोटीस (सरहेशी એક્ટ, २००२ ક्खम-९३ ની પેટા કલમ(૨) હેઠળ)

આથી નોટીસ આપવામાં આવે છે કે નીચેના ઉધારકર્તા **શ્રી પ્રવિભાગ કાનગુભાઈ મોરડીસા (ઉધારકતા**) તેમણે મેળવેલી પિરાણ સવલતો જેમ કે હાઉસીંગ લોન બેંક માંથી શ્રી પ્રવિકાભાર્થ કાનજીભાર્થ મોરકીથા (ઉદારકતાં) જાનામે લીધેલ જેની મૂળ રકય અને વ્યાજ ભરવામાં કસૂર કરેલ છે અને તેમની લોન નોન પરફોર્યિંગ એસેટ (એનપીએ) વર્ગીકૃત કરવામાં આવી છે. તેમને નોટીસો સિક્યુરીટાઈઝેશન અને રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એલેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ - ૨૦૦૨ ની ક્લમ ૧૩(૨) અંતર્ગત તેમના છેલ્લા અને જાણીતા સરનામા ઉપર પાઠવવામાં આવેલ પરંતુ તે "Left" રીમાર્ક સાથે પરત થયેલ છે. તેથી આ જાહેર નોટીસ મારકતે જાજ કરવામાં આવે છે.

क्षारक्याचै जान क्रव झडवारी
શ્રી પ્રવિભાઈ કાનજીભાઈ મોરડીયા
(ક્લાસ્કતાં), પ્લોટ નં. ૩૦૦, શીવ દર્શન
રેસીડેન્સી, શેખપુર, સબ જીલ્લો - કામરેજ,
જીલ્લો - સુરત (ગુજરાત) - ૩૯૪૫૪૦.
श्रीमती शिक्षाक्षेत्र प्रविशक्षार्थं मोरडीया
W/o પ્રવિભાઇ કાનજીભાઇ મોરડીસા
Or for the con and a class

સ્થાવર મિલકતનો પ્લોટ નં. ૩૦૦, જેનું ક્ષેત્રફળ ૮૦.૨૩ સ્કે.મી., "શીવદર્શન રેસીડેન્સી" જે સ્થિત જમીનનો આર. એસ. નં. ૪ + ૩૧૪ + ૩૧૫, ૩૧૦, ૩૧૧, ૩૧૨, ૩૧૩, જુનો બ્લોક નં. ૧૩૫છીનો રી-સર્વે ન્યુ બ્લોક નં. ૧૪, સબ પ્લોટ નં. ૨, જેનું ક્ષેત્રફળ ૩૩૮૧૮.૨૫ સ્કે.મી., ગામ - શેખપુર, સબ જીલ્લો - કામરેજ, સુરત. ચતુઃસીમા:- ઉત્તરે : પ્લોટ નં. ૨૯૯, દક્ષિણે : પ્લોટ નં. ૩૦૧, પૂર્વે : સોસાયટીનો રોડ, પશ્ચિમે : પ્લોટ નં.

મોર્ગેજ ડીડ / દસ્તાવેજો ની વિગતો : તા. ૨૩.૦૮.૨૦૧૮ ના રોજ અસલ સેલ ડીડ નં. ૨૧૨૬૦, રજીસ્ટાર ઓફિસ નો સબ રજીસ્ટાર, કામરેજ ની તરફેણમાં જે. ડી. ડેવલોપર - ભાગીદારી પેઢીની તરફેણમાં

शेननो प्रकार	એકાઉન્ટ નં.	बोननी २७भ	વ્યાજનો દર	એनपीએ नी तारीभ	डीमान्ड नोहीसनी तारीण	કુલ ભા રી રક મ તા. ૨૩.૦૬.૨૦૨૧
।6र्सींग बोन	\$05638C330	-\000, PF	6.20 %	0505.0 <i>P.F</i> E	23.05.2021	₿I. ₹4,50,5€3.03

જજાાવવામાં આવે છે. તેમા કસૂર થતાં આ નોટીસની તારીખથી ૬૦ દિવસ પૂરા થયા બાદ સિકયુરીટાઈઝેશન અને રીકન્સ્ટ્રકશન ઓક કાયનાન્સીયલ એસેટ્સ અને એન્કોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ - ૨૦૦૨ ની ક્લમ ૧ ૩ની પેટા ક્લમ (૪) મુજબ આગળ પગલાં ભરવામાં આવશે. તારીખ : ૨૩.૦૭.૨૦૨૧, સ્થળ : સુરત અધिकृत अधिकारी, सेन्ट्रस ॲंड ओફ ઇन्डिया

કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

એક પબ્લીક લિમિટેડ કંપની જેનો CIN - L40102GJ2008PLC083302 છે. રજી. ઓફીસ : કે.પી. હાઉસ, ઈશ્વર ફાર્મ જંક્શન બીઆરટીએસ ની સામે, **૦લીસ આઈવીએફ સર્કલ પાસે, કેનાલ રોડ, ભટાર, સુરત- ૩૯૫૦૧**¢, ગુજરાત, ઈન્ડિયા

જાહેર નોટીસ ગુજરાત વિજનિયમન પંચ સમક્ષ

બાબતે:

કેપીઆઈ ગ્લોબલ ઈન્ફાસ્ટ્રકચર લિમિટેડ (આ કંપનીને હવે પછી કેજીઆઈએલ તરીકે ઓળખવામાં આવશે) કે જે ર્ઘલેક્ટ્રીક્સીટી એક્ટ, ૨૦૦૩ ને જીઈઆરસી (લાઈઝર્નીંગ ઓફ ઈલેક્ટ્રીક્સીટી ટ્રેડીંગ) રેગ્યુલેશન, ૨૦૦૫ ની કલમ ૧૪,૧૫,૧૬,૧૮,૫૨ અને ૮૬(૧) (ડી) ની પેટા ક્લમ (૧) હેઠળ ઈન્ટ્રા સ્ટેટ ટ્રેડીંગ લાયસન્સ માટે ગુજરાત ઈલેક્ટ્રીકસીટી રેગ્યુલેટરી કમિશનને તારીખ:૦૯.૦૨.૨૦૨૧ ના રોજ અરજી કરેલ છે. (લાયસન્સ એપ્લીકેશન નં. ૦૨/૨૦૨૧)

ર. કે જીઆઈએલ ગુજરાત રાજ્યમાં ''વિજળીનો વેપાર હાથ ધરવા'' પરવાનગી માંગેલ છે. 3. તારીખ: 3૧.૦૩.૨૦૨૧ ના રોજ કંપનીની કુલ્લે નેટ વર્થ રૂા. ૧૨૦.૧૬ કરોડ હતી, કૃાઈનાનસીયલ વર્ષ ૨૦૨૦-૨૧ નું વાર્ષિક

ટન ઓવર રૂા.૧૦૩.૯૪ કરોડ હતું. કેજીઆઈએલ ઘણું બધું ભંડોળ તથા ધંધામાં બહોળો અનુભવ ધરાવે છે. ૪. લાઈસન્સ મેળવ્યા ભાદ, કેજીઆઈએલ સમગ્ર ગુજરાત રાજ્યમાં વીજળીનો વેપાર આવતા પાંચ વર્ષમાં નીચે મુજબનો કરવા માંગે

ફાઈનાન્સીચલ વર્ષ	5051-55	5055-53	5053-58	5058-54	5054-58
દર વર્ષે ચુનિટ – મીલીચનમાં	39.00	७ ७. ५ ०	936.40	296.00	390.00

અરજદાર કંપની તેવા વાંદ્યાની રજુઆતો મંગાવે છે. ૬. નિરીક્ષણ માટે અરજી તેમજ તેને લગતા તમામ કાગળોની ચકાસણી શ્રી ઈરફાન એસ. મોમ્બાસાવાલા (કેજીઆઈએલ ના કાનૂની સલાહકાર) પાસે નિરક્ષણ માટે ઉપરોક્ત ઓફીસના સરનામે ઉપલબ્ધ છે. આ અરજીની ઈલેક્ટ્રોનીક નકલ <u>www.kpgroup.co</u> ન મેનુ ''પાવર ટ્રેડીંગ એપ્લીકેશન'' પરથી ફ્રી ડાઉનલોડ કરી હાકાય છે. અરજીની નકલ અને તેને લગતા બીજા તમામ કાગળો રૂા.3પ૦/– રોકડે થી અથવા તો કેપીઆઈ ગ્લોબલ ઈન્ફાસ્ટ્રક્ચર લિમિટેડના નામનો ડીમાન્ડ ડ્રાફ્ટ ધ્વારા ઉપરોક્ત સરનામેથી

ખરીદી શકાશે. અરજીની નકલ ટપાલથી પ્રાપ્ત કરવા માટે ટપાલ ખર્ચના રૂા.૫૦/- વધુ ચુકવવાના રહેશે.

ં. ઉપરોક્ત અરજી સામે જે કોઈપણ વ્યક્તિને પોતાના વાંધાઓ રજુ કરવામાં રસ હોય તેઓએ પોતે જેનો આધાર લેતા હોય તે દસ્તાવેજો સાથેની પોતાની અરજી, પાંચ સેટમાં, તેમજ તેના ટેકામાં આવશ્ચક એફ્ડિવીટ સાથે, સેક્રેટરી, ગુજરાત વીજનીથમન પંચ, છકી માળ, ગીફ્ટ વન, રોડ પ સી, ઝોન પ, ગીફ્ટ સીટી, ગાંધીનગર-3૮૨ રૂપપ ને આ જાહેર નોટીસ પ્રકાશિત થથાના ૩૦ દિવસની અંદર મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે અને તેની એક નકલ નીચે સહી કરનારને પણ મોકલવાની રહેશે.

તારીખ ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૧

સુરત

ઈરફાન મોમ્બાસાવાલા સહી/-લીગલ એડવાઈઝર, કેપીઆઈ ગ્લોબલ ઈન્ફાસ્ટ્રક્ચર લિ.

सेन्द्रम बैंक ओफ इंडिया ट्रिसाइया बेक ओफ इंडिया

ભઢાર રોક, સુરત શાખા : રાજહંસ ઓલિમ્પિયા, દુકાન નં. ૧૦૪ થી ૧૦૮, અપર ગ્રાઉન્ડ ફ્લોર,

भिरवे मुस्त्व भिवश्तनुं वर्धन

શેખપુર, સબ જીલ્લો - કામરેજ, જીલ્લો -સુરત (ગુજરાત) - ૩૯૪૫૪૦.

(૧). શ્રી પ્રવિભભાઈ કાનજીભાઈ મોરડીયા, (૨). શ્રીમતી શીલ્પાબેન પ્રવિભ્રભાઈ મોરડીયા.

ोननो प्रकार	એક।ઉન્ટ નં.	ह्योजनी २७भ	વ્યાપનો દર	એનપીએ ની તારીખ	डीभान्ड नोहीसनी तारीज	कु व आर्थी २६भ ता. २३.०५.२०२१
।ઉर्शींभ बोन	A0563AC330	-\000, <i>55</i>	6.20 %	0505.0 <i>P.F</i> E	23.05.202 2	ફા. ૨૫,૬૦,૬૯૩.૦૩
शेत्र एकवर्ण	माउना अना तशर	માં હોતાઈ ગ્રહ્યા છે	மேறிக்க நீது:	ગ્રહ્મનિ આશ્રી આ નોટી:	य प्रशिक्ष भगना इत दिवा	ાંદર લિક્સ નિયર દેવાલે લ્ફાર્સ નિય

કામરેજ ચાર રસ્તા શાખા, ગામ નવાગામ, નવસર્જન સોસાયટી પાસે, તા. કામરેજ, જિ. સુરત. ફોન : 02621-255600, 253600 **ย-ม**ัด: kamrej@bankofbaroda.com



સાંકેતિક કબજા નોટીસ (સ્થાવર મિલકત)

આથી નીચે સહી કરનાર બેંક ઓફ બરોડાના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, 2002 (54 ઓફ 2002) તથાસિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002ના નિયમ કસપ્રિત કલમ 13(12) અંતર્ગત મળેલ સત્તા હેઠળ સદર નોટીસમાં પાઠવેલી રક્મ અને આગળના વ્યાજસાથેની બાકી રકમ સદરહુ નોટિસ મળ્યાની તારીખથી 60 દિવસમાં પરત ચુકવવા જણાવાયું હતું. કરજદાર/મોર્ટગેજર સદરહુ રકમ પરત ચુકવવામાં નિષ્ફળ જતા કરજદાર/મોર્ટગેજર અને જાહેર જનતાને આ સાથે નોટિસ આપવામાં આવે છે કે સહી કરનારે સદરહુ ઓડીનેન્સ એક્ટની કલમ 13(એ) અને સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમ 2002ના નિયમ 8 સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ અહીં નીચે જણાવેલી મિલકતનો સાકેતિક કબજો તો. 01-02-2021ના દિને એઠાળી લીકેલ બ

જ્જિલ્લા કર્યા કર્યા કર્યા છે. છે. છે. જે કર્યા કર્યા કરાય કર્યા કરવા માના કરવા માના કરવા કર્યા કર્યા કર્યા કર 9-2021ના કિને સંભાળી લીધેલ છે. અહીં કરજકાર/મોર્ટગેજરનું શ્વાન કોરવામાં આવે છે કે, જ્જાવેલ સમય મર્યાકામાં સેક્શન 13ના સબ સેક્શન (8) હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતોને બાકી લેજ્ઞા ભરપાઈ કરી

પાછી મેળવી શકો છો. કરજદાર/મોર્ટગેજર અને જાહેર જનતાને આથી જાહેર ચેતવણી આપવામાં આવે છે કે, તેમણે સદરહુ મિલકત બાબતમાં કોઈ વ્યવહાર કરવો નહીં અને કોઈપણ **બેંક ઓફ બરોડા**

કામરેજ શાખા, સુરત માટે વ્યાજની સ્ક્રમ, બાકી સ્ક્રમ તથા અન્ય ખર્ચાઓ વસુલાતને પાત્ર રહેશે.

ક્રમ	સ્વાદાર/જાનાગદાર/ મોર્ટગેજરનું નામ	ાડમાન્ડ નાટારાના તારીખ અને રકમ	મિલકતની વિગત
	શ્રી હર્ષદભાઈ નારણભાઈ હુડકા, શ્રીમતી નિમીષાબેન હર્ષદભાઈ હુડકા અને શ્રી જીતુભાઈ લવજીભાઈ પીપલીયા (જામીનદાર)	તા. 09-09-2019 રૂા.13,86,696.78 અને તેના ઉપરનું વ્યાજ ઉપરાંત રીવર્સલ વ્યાજ અને અન્ય ખર્ચાઓ	તમામ ભાગ અને હિસ્સા સહિત મિલકત ક્લેટ નં. 404, બિલ્ડીંગ નં.G, ભક્તિધારા રેસીડેન્સી-2, માપ આશરે 92.38 ચો. મી., જેનો બિલ્ટ અપ એરિયા 646 ચો.ફુટ, કથિત બિલ્ડીંગના રસ્તા અને જમીનમાં અવિભાજીત પ્રમાણસર હિસ્સા સાથે માપ38.13 ચો. મી., રેવન્યુ સર્વે નં.54, લ્લોક નં.128, ગામ સાયણ, તા. ઓલપાડ, જી.સુરત. જે મિલકત શ્રી હર્ષકભાઈ નારણભાઈ હુંડકાના નામે સ્થિત છે. જેની ચતુર્સિમા : ઉત્તર : ખુલ્લી જગ્યા, ક્લિણ : ફ્લેટ નં.G-401, પૂર્વ : ખુલ્લી જગ્યા, પશ્ચિમ : ફ્લેટ નં.G-403.
۷٠	શ્રી નિલેશભાઈ અર્જનભાઈ પીપલીયા (કરજદાર) અને શ્રીમતી રેખાબેન લાલજીભાઈ પીપલીયા (સહ-કરજદાર)	અને તેના ઉપરનું વ્યાજ	તમામ ભાગ અને હિસ્સા સહિત મિલકત, પ્લોટ નં.369, અંદાજીત માપ 40.18 ચો.મી., સી.ઓ.પી. અને રસ્તામાં અવિભાજીત પ્રમાણસર હિસ્સા સાથે, "ગુબશાંતિ રેસિ.ન્સી વિભાગ-1", બિલ્ટ અપ એરિયા 335.94 ચો.ફુટ, બ્લોક નં.133, ગામ ઉમરા, તા.ઓલપાડ, જી.સુરત, જે મિલકત શ્રી નિલેશભાઈ અર્જનભાઈ પીપલીયા અને શ્રીમતી રેખાબેન નિલેશભાઈ પીપલીયાના નામે સ્થિત છે. જેની ચતુર્સિમા : ઉત્તરઃ પ્લોટ નં.368, દક્ષિણ : પ્લોટ નં.370, પૂર્વ : સોસાયટીનો રસ્તો, પશ્ચિમ : પ્લોટ નં.350.
	શ્રી પિયુષભાઈ નારકાભાઈ માંગુકિયા (કરજદાર), શ્રીમતી નયનાબેન પિયુષભાઈ માંગુકિયા (સહ-કરજદાર), શ્રી નારકાભાઈ વેલજીભાઈ માંગુકિયા (સહ-કરજદાર), હસમુખભાઈ દામજીભાઈ માંગુકિયા (જામીનદાર), શ્રી ભાવેશભાઈ બુરાભાઈ માંગુકિયા (જામીનદાર)	અને તેના ઉપરનું વ્યાજ ઉપરાંત રીવર્સલ વ્યાજ અને અન્ય ખર્ચાઓ	તમામ ભાગ અને હિસ્સા સહિત મિલકત, 'લોટ નં.652, માપ 60.11 ચો.મી. એટલે કે 72.00 ચો.યાર્ડ, "નંદીની રેસીડેન્સી વિભાગ-2, વિભાગ-3, કથિત સોસાયટીની સી.ઓ.પી. અને કોમન રસ્તામાં અવિભાજીત પ્રમાણસર હિસ્સા સાથે માપ 33.71 ચો.મી., બ્લોક નં.201, રેવન્યુ સર્વે નં. 66,178,178,179, ગામ વેલંજી, તા.કામરેજ, જી.સુરત. જેની ચતુર્સિમા : ઉત્તરઃ પ્લોટ નં.651, દક્ષિણ : પ્લોટ નં.653, પૂર્વ : સોસાયટીનો રસ્તો, પશ્ચિમ : સોસાયટીનો આંતરિક રસ્તો.

તા. 09-09-2019 રા.12,98,686 અને તેના ઉપરનું વ્યાજ રેસીડેન્સી-2, કથિત બિલ્હીંગમાં અવિભાજીત પ્રમાણસર હિસ્સા સાથે માપ 38.13 ચો.મી., રેવન્યુ સર્વે નં.54 ઉપરાંત રીવર્સલ વ્યાજ એકી એટલે કે બ્લોક નં.128, ગામ સાયણ, તા.એલપાડ, જી.સુરત. જેની ચતુર્સિમા : ઉત્તરઃ લાગુ બિલ્હીંગ નં.L, કમિશ : ક્લેટ નં.K-302, પૂર્વ : લાગુ સોસાયટીનો રસ્તો, પશ્ચિમ : ક્લેટ નં.K-304.

Torrent-

<u>વીજપ્રવાહ બંધ રહેવા બાબત</u>

ગ્રાહકોને ગુવ્રવત્તાસભર વીજપુરવઠો આપવાના હેતુથી નીચે દર્શાવેલ સબસ્ટેશનોના નેટવર્ક મેઈન્ટેનન્સનું આયોજન કરેલ છે. આ સબસ્ટેશનોમાંથી વીજપુરવઠો મેળવતા ગ્રાહકોનો સવારના ૯ : ૦૦ થી સાંજના ૫ : ૦૦ કલાક દરમ્યાન વીજપૂરવઠો બંધ રહેશે. અનુસૂચિત સમય પહેલા વીજપુરવઠી પુનઃકાર્યરત કરવા માટે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.

• ૦૬-૦૯-૨૦૨૧ : નાશાંવટ (ગાયત્રી વિહાર એપાર્ટમેન્ટ) વિમલનાથ (લબ્બૈક એપાર્ટમેન્ટ-નાણાંવટ)

૦૭-૦૯-૨૦૨૧ : ભારત (સોદાગર વાડ) ધન પરિન (સૈયદપુરા)

• ૦૮-૦૯-૨૦૨૧ : ગજીવાલા ઈન્ડ. (સગરામપુરા) ધન મોહન (સગરામપુરા) અમૃતશાંતિ (નવાપરા)

• ૦૯-૦૯-૨૦૨૧ : મા પ્રતાપ (મહારાજ્ઞા પ્રતાપ) હલિમસાબાવા ટેકરા (રૂદેરપુરા)

આશીર્વાદ પેલેસ એમ-નં-૨ • ૧૧-૦૯-૨૦૨૧ : શિવ દર્શન એપાર્ટમેન્ટ. (ઉમાભવન)

• ૧૨-૦૯-૨૦૨૧ : પરિન જેમ્સ (અંજારીયા વાડી)

અસુવિદ્યા બદલ દિલગીર છીએ वीष स्थापनमां ELCB/RCCB खगाडवाथी वीष અકस्मात निवारी शडाथ.

3 8141970070 હેલ્પ લાઈન નં. 0261-2551912 / 19128 (Toll Free), પોર્ટલ : connect.torrentpower.com અને મોબાઈલ એપ : Torrent Power Connect



हुन्त वैक क्विताय Bank असर्व शोधिंग सेन्टर, अंतिका निकेतन गेरनी पासे, पास्ते पोर्डनर, सुरुत - ३९५००६.

<u> પરિસિષ્ટ - ૧૦ પગ્રેશન जोटीस (६६म - ૧૩(४) (स्थायर मिखन्त मार्ट)</u>

આથી નીચે સહી કરનાર કેંગ્રેસ ભેંક ના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન બોક કાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્કોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, ૨૦૦૨ (૫૪ ઓફ ૨૦૦૨) (ત્યાર બાદ એકટ તરીકે ઓળખાય છે) તથા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ 3 સહિત કલમ ૧૩(૧૨) અંતર્ગત મળેલ સત્તાની રૂએ તા. ૦૫.૦૪,૨૦૨૧ ના રોજ ઉધારકર્તા શ્રી વિજયકુભાર જેસીંગભાઇ ભરવાડ (ઉધારકર્તા) અને ઘુધાભાઇ જેસીંગભાઇ ભરવાડ (સલ-ઉધારકર્તા) તેમનો એકાઉન્ટ નં. ৬૧૭૯૯૪૦૦૦૧૪૪૨ ને જરી કરીને નોટીસમાં જણાવેલ ફા. ૧૨,૧૦,૬૮૬-૯૬ (ફા. ભાર લાખ દસ હન્નર છરસો છચાસી અને નવ્વાસું પૈસા પુરા) વત્તા તા. ૨૯.૦૨.૨૦૨૦ ના રોજ થી ચડત

વ્યાજ અને અન્ય ખર્ચાઓ સાથે ૮૦ દિવસની અંદર બાંકી રકમ સહિત ચુકવવા જણાવેલ. ઉધારકર્તા ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તા તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમની કલમ ૧૩ ની પેટા કલમ (૪) તથા ઉક્ત નિયમો હેઠળના નિયમ ૮ અને ૯ અંતર્ગત મળેલ સત્તાની રૂએ અધોહસ્તાક્ષરકર્તાએ મિલકતનો તા. ૦૧.૦૯.૨૦૨૧ ના રોજ નિમ્નલિખિત

ઉધારકર્તાને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલકત અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ મિલકત અંગે કરેલો કોઈપણ વ્યવહાર **કૅનેરા બેંક** ની રકમ **રા**. ૧૩,૫૦,૮૦૮.૯૧ (ફા. તેર લાખ સતાયન હજાર આઠસો ઇઠચોતેર અને એકાલું પૈસા પુરા) તા. ૩૧.૦૮.૨૦૨૧ ના સુધી અને વ્યાજ સાથેના બોજા સહિત રહેશે.

"સરફેસી કાર્યદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે મુકરર ઉધારકર્તાઓને મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે."

स्थावर भिस्कतनुं वर्धन સુધારેલ પ્લાન મુજબ પ્લોટ નં. ૨૧૫ (જુનો પ્લોટ નં. એ-૧૭૨), "શીવનગર" થી જાણીતી સોસાયટી, જે સ્થિત દાદા ભગવાન મંદિરની પાછળ, કામરેજ, રેવન્યુ સર્વે નં. ૩૮૦, બ્લોક નં. ૩૪૭, ગામ - કામરેજ, તાલુકો કામરેજ, જીલ્લો - સુરત, કુલ આશરે ક્ષેત્રફળ (પ્લોટ એરીયાનું ક્ષેત્રફળ ૩૯.૦૨ સ્કે.મી. + અવિભાજીત હકક અને હિસ્સા સાથેના રોડ અને સીઓપીનું ક્ષેત્રફળ ૫.૦૨ રહે.મી.) ૪૪.૦૪ રહે.મી. સ્રતુ:સીમા :- ઉત્તરે : સોસાયટીનો રોડ, દક્ષિણો : પી એન ૨૩૮, પૂર્વેં : પી એન ૨૧૪, પશ્ચિમે : પી એન ૨૧૬.

तारीण : ०१.०१.२०२१, २०१७ : सुरत

સેન્ટ્રલ ભેંક ઓફ ઇન્ડિયા | કીકોલી સાળા : પ્લોટ નં. ૭, ક્રિપ્ન કુંજ સોસાયટી, सेन्द्रल बैंक ओफ इंडिया भीबेनियम नी साथे, ખરવાસા राउ, उक्तान्य, धुरत - उल्हर २००, कोब बं. ०२११ - २०१८८१५.

સહી/-, અધિકૃત અધિકારી, કેનેરા બેંક

विक्योरीटी र्वन्टरेस्ट (गोन्होरमेन्ट) जियम - २००२ ढेडण जियम ८(९) प्रोशन नोदीय (स्थापर मिक्कत मार्ड)

આથી, <mark>સેન્દ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કોંકોલી શાખા (સુરત)</mark> ના નીચે મહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકેન્સ્ટ્રકક્ષન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૫૪ ઓફ ૨૦૦૨) તથા કલમ ૧૩(૧૨) હેઠળ મળેલી સત્તા સાથે સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ તથાં નિયમ ૩ અંતર્ગત તા. ૨૩.૦૦.૨૦૧૯ ના રોજ ક્લમ ૧૩(૨) હેઠળ ઉધારકર્તા મે. વિરોજ્યા એક્ઝિમ (ભાગીદારી પેટી) તેમના ભાગીદારો (૧) દિવ્યાંગ કનુભાઇ પટેલ (ભાગીદાર - ૧), (૨). શ્રીયતી **વિરવ દિવ્યાં**ગ પહેલ (ભાગીદાર-૨) ને માંગણા નોટીસ જારી કરીને નોટીસ મળ્યાની તારીખથી ૮૦ દિવસીની અંદર ભાકી ૨ક્કમ શા. ૨,૫७,૫૯,૪૧૫/- (શા. છે ૭૨ોઠ સત્તાવન લાખ ઓગાશસા**તીઠ હજા**ર શાસ્ત્રો પંદર પુસ) વત્તા તા. ૨૩.૦૭.૨૦૧૯ ના રોજ થી ચડત વ્યાજ અને ખર્ચાઓ

ઉધારકર્તા / શ્વમીનદાર ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તા અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમ ૧ ૩ની પેટા કલમ (૪) હેઠળ રૂલ ૮ અને ૯ સાથે મળેલી સત્તાની રૂએ અધિકૃત અધિકારીએ તા. ૦૧.૦૬.૨૦૨૧ ના રોજ નીચે જજ્ઞાવેલ મિલકતનો પ્રત્થક્ષ કઠાનો લઇ લીધેલ છે.

ઉંધારકર્તા / જામીદારોને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલકત અંગે કોઈપણ જાતનો ત્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ સ્થાયી મિલકત અંગે કરેલો કોઈપણ વ્યવહાર સે**ન્દ્રલ** હોંક ઓફ ઇન્ડિયા, ક્રીકોલી શાળા (સુરત) ની રકેમ ફા. ર,૫૦,૫૯,૪૧૫∤- (રૂા. છે કરોડ સત્તાવન લાખ ઓગણસાહીક લબર સારસો પંદર પુરા) વત્તા તા. ર.ચ.૦૭.૨૦૧૯ ના રોજ થી ચડત વ્યાજ અને અન્ય ચાર્જાસ સાથેના બોજાને આધીન રહેશે. (કલમ ૧૩(૨) હેઠળની ડીમાન્ડ નોટીસ આપ્યા પછી આવેલ રકમની ઈફેક્ટ

"सरहेंची कायहाजी कवम १३जी पेक्ष कवम ८ जी कोअवार्ड प्रत्ये ईधास्कर्ताओर्जु मुक्स्र मिवकत છોકાવવા માટે મળવા પાત્ર સમક્ષ ભાગતે ધ્યાન દોરવામાં આવે છે."

स्थावर भिव्हतनुं वर्धन

શ્રી દિવ્યાંગ કનુભાઈ પટેલના નામની સેલ ડીડ મુજબ તમામ ભાગ અને હિસ્સો રહેઠાલ લાયક મિલકત નો પ્લોટ નં. ૫૫, શ્રીનાવજી બંગ્લોઝ, મોટા વરાછા પોલીસ ચોકી ની પાસે, મોટા વરાછા, સુરત.

ર્ટ્ટારલાઇનપીએસ એન્ટરપ્રાઇસિઝ મગાઉ સ્ટારલાઇન પ્રિસિયસ સ્ટોન લિમિટેડ એન્ડ પ્યોર ગિક્ટકેરેટ લિમિટેડ તરીકે જાણિ

(CIN:L36910GJ2011PLC065141) રજીસ્ટર્ડ ઓફિસ: દુકોન નં.- એફ/૧, પહેલે માળે, અઠવા આર્ક શોપિંગ સેન્ટર,

યતિમ ખોના સામે, અઠવા ગેટ, સુરત-૩૯૫૦૦૧. ગુજરાત. ફોન નં.: ૦૨૬૧-૨૬૦૦૩૪૩, મો.: +૯૧-७०૪૩૯૯૯૦૩૦ ध-भेधलःinfo@starlineps.com wesite:www.starlineps.com

કંપનીની ૧૦મી સામાન્ય વાર્ષિક સભા, હિસાબી ચોપડા બંધ કરવા **અને ઇ-વોટીંગની માહિતી માટેની નોટીસ** માથી જણાવવાનું કે સ્ટારલાઇનપીએસ એન્ટરપ્રાઇસિઝ લિમિટેડ (અગાઉ સ્ટારલાઇન પ્રીસીયર

સ્ટોન લિમિટેડ અને પ્યોર ગીફટકેરેટ લિમિટેડ) તરીકે જાણીતી કંપનીના સભ્યોની ૧૦મી સામાન્ય વાર્ષિક સભા (એજીએમ)નું આયોજન સોમવાર રહમી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ બપોરે ૧૨.૩૦ ક્લાકે કંપનીની રજીસ્ટર્ડ ઓફીસ દુકાન નં. એફ/૧, પહેલે માળે, અઠવા આર્ક શોપિંગ મેન્ટર, યતિમ ખાના સામે, અઠવાગેટ, સુરત, ૩૯૫૦૦૧. ગુજરાત ખાતે યોજવામાં આવી છે. જેમાં નોટીસમાં જણાવ્યાં મુજબ ૧૦મી સામાન્ય વાર્ષિક સભામાં એક્સપ્લેનેટરી સ્ટેટમેન્ટ ડાયેરકટર્સ રિપોર્ટ,ઓડીટર રિપોર્ટ અને કંપનીના ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પુરા થતા 👊 માટેના ઓડીટેડ ફાઇનાન્શ્યલ સ્ટેટમેન્ટસ સંબંધી કામકાજ હાથધરવામાં આવશે.

આર્થિક વર્ષ ૨૦૨૦-૨૧ના વાર્ષિક અહેવાલો તથા એટન્ડન્સ પુક રલીપ, પ્રોક્સી ફોર્મ, વગેરે 3જી સપ્ટેમ્બર,૨૦૨૧ના રોજ નોટીસ સાથે તમામ સભ્યો કે જેમના નામ ૨૭મી ઓગસ્ટ ૨૦૨૧ સુધી કંપનીના ૨જીસ્ટર્ડમાં નોંધાચેલા હોય તેમને મોકલી આપવામાં આવ્યા છે. કપ્યા નોંધ લેશો કે, કંપનીના સભ્યોને એમસીએના પરીપત્ર મુજબ સભ્યોને નોટીસની સાપેક્ષ નકલો મોકલવામાં નહીં આવે. આ દસ્તાવેજો કંપનીની વેબસાઇટ www.starlineps.com ਸ਼ਕੇ ਕੇशਕ਼ ਜ਼ਿਣ੍ਹੀ ਟੀਟੀਨ ਤਿਪੀਨੀਟਦੀ લਿમਿਟੇડ (એਕએસડીએલ)ਕੀ http://www.evoting nsdLoom પર ઉપલબ્ધ છે.

વધુમાં જણાવવામાં આવે છે કે, કંપનીઝ એક્ટ ૨૦૧૩ ખંડ ૧૦૮, કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ મેડમીનીસ્ટ્રેશન) ફલ્સ ૨૦૧૪ ના રૂલ ૨૦ સેળી (લિસ્ટીંગ ઓબ્લીગેસન્સ એન્ડ ડ્સિક્લોઝર રિક્વાયરમેન્ટ) રેગ્યુલેશન ૨૦૧૫ના રેગ્યુલેશન ૪૪ને ધ્યાનમાં લેતા કંપની તરફથી એજીએમન શ્વળેથી દુરના સ્થળ માટે ઇલેટ્રોનીક વોર્ટીંગ ફેસીલીટી (''રીમોટ ઇ-વોર્ટીંગ'') એનએસડીએ તરફથી પુરી પાડવામાં આવશે. અને નોટીસમા જણાવવામાં આવેલા તમામ ઠરાવો પર મતદાન થઇ શકરોં. રિમોટ ઇ-વોટીંગની માહિતી નીચે મુજબ છે:

૧) રીમોટ ઇ-વોટીંગ શુક્રવાર ૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૧ (સવારે ૯.૦૦ વાગ્યે) શરૂ થશે અવ રવિવાર રદ્દમી સપ્ટેમ્બર, ૨૦૨૧ (સાંજે ૫.૦૦ વાગ્યે) પુરુ થશે. ત્યાર બાદ ઇ-વોટીંગ

મોડ્યલ પર મતદાન થઇ શક્શે નહીં.) સભ્યોને મતદાનના અધિકારનું પ્રમાણ ૨૦મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ કંપનીની પેઇડપ શેર

કેપીટલના આધારે આપવામાં આવશે. ૩) કોઇપણ વ્યક્તિ ૩જી સપ્ટેમ્બ૨, ૨૦૨૧ના રોજ સભ્ય બને અને ઇક્વીટી શેર ધરાવતી હોર અથવા ૨૦મી સપ્ટેમ્બર, ૨૦૨૧ની છેલ્લી તારીખ સુધીમાં નોટીસ અને શેર ધરાવતા હો તેમણે ઇ-વોટીંગ હક મેળવવા માટે લોગીંન આઇડી અને પાસવર્ડની સાથે evoting@nsd

co.in अने info@starlineps.com पर विनंती मोड्सवानी रहेशे. ૪) સભ્ય તે કે તેણી દ્વારા એક વખત મતદાન થયા પછી તે બીજી વખત મતદાન નહીં કરી શકે

કરીથી મતદાન કરી શકશે નહીં. સભ્યોની ઇ-વોટીંગ માટેની કોઇપણ પુછપરછ હોય તો તેમણે ફ્રીક્વન્ટલી આસ્કડ ક્વેશ્વન એફએક્યુએસ) પર મોકલવા સભ્યો અને ઇ-વોટીંગનો ઉપયોગ કરનારાઓ માટે મેન્યુઅ તદાન પંણ ડાઉનલોડીંગ સેક્શન http://www.evoting.nsdl.com/ સંપર્ક સાધી શકે દ મથવા કુમારી પલ્લવી મહાત્રે આસીટન્ટ મેનેજર, એનએસડીએલ, ચોથે માળે, 'એ'વીંગ, ટ્રે ાર્લ્ડ,કમંલા મિલ્સ કંપાઉન્ડ , લોઅર પરેલ મુંબઇ-४०००९૩ , ઇ-મેઇલ: pallavi@nsdl.co.in અન રલીફોન નં. ૦૨૨-૨૪૯૯૪૫૪૫ અને ટોલ ફ્રી નં. : ૧૮૦૦-૨૨૨-૯૯૦.નો પણ સંપર્ક કરી શકે છે

વધુમાં જણાવવાનું કે કંપનીઝ એક્ટ , ૨૦૧૩ના ખંડ ૯૧ની સાથે લાગુ પડતા રૂલ્સ અને સેબ <u> વિસ્ટીંગ</u> ઓબલીગેશન એન્ડ ડિસ્કલોઝર રિક્વાયરમેન્ટસ) ના રેગ્યુલેશન ૨૦૧૫ ના રૂલ ૪૨ મુજબ કંપનીની શેર ટ્રાન્સફર બુક ર૧મી સપ્ટેમ્બર, ૨૦૨૧ થી ૨૯મી સપ્ટેમ્બર,૨૦૨૧ (બંને

> બોર્ડ ઓફ ડિરેક્ટર્સના હુક્મથી વર્તી સ્ટારલાઇનપીએસ એન્ટરપ્રાઇઝ લિમિટેડ ખુશબુ મોદી કંપની સેક્રેટરી અને કમ્પાઅન્ટ ઓફીસર

ળઃ સુરત ખ: o3-o∈-૨o૨૧

એસીએસ નં .: ૫७૩૨૩

જે. એસ. પટેલ, મુખ્ય પ્રબંધક, અધિકૃત અધિકારી, બેંક ઓફ બરોડા. તા. 01-09-2021 | સ્થળ : સુરત Printed by Manoj bhai Laljibhai Mistryat GUARD IAN PRESS B-17/2, Hojiwala Industrial Estate, Sachin-Palsana Road, Near Sachin, Surat on behalf of owners Manoj bhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-3 000 2 on behalf of owners Manoj bhai Laljibhai Mistry Editor: Manoj bhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-3 000 2 on behalf of owners Manoj bhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-3 000 2 on behalf of owners Manoj bhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-3 000 2 on behalf of owners Manoj bhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-3 000 2 on behalf of owners Manoj bhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-3 000 2 on behalf of owners Manoj bhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-3 000 2 on behalf of owners Manoj bhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-3 000 2 on behalf of owners Manoj bhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-3 000 2 on behalf of owners Manoj bhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-3 000 2 on behalf of owners Manoj bhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-3 000 2 on behalf of owners Manoj bhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-3 000 2 on behalf of owners Manoj bhai Laljibhai Mistry at Guardian House, Suman Desaini Wadi, Udhna Darwaja, Ring Road, Surat-3 000 2 on behalf of owners Manoj bhai Laljibhai Mistry at Guardian House, Road, Roa

શ્રીમતી પ્રભાબેન વિફલભાઈ

ી વિકલભાઈ વાલજીભાઈ

પલીયા (સહ-કરજદાર)

. રાહુલ વિકલભાઈ પીપલ

(સહ-કેરજદાર) , શ્રી જીતુભા

વજીભાઈ પીપલીયા

(જામીનદાર)

ાપલીયા (કરજદાર)